

श्री

जैनधर्म प्रकाश.

पुस्तक २४ भं.

संवत् १९६४ ना वैतर्थी संवत् १९६५ ना दुष्टिगण्डि. अंक १२३

शार्दूलविक्रीमितम्.

नक्षिस्तीर्थकृतां नतिः प्रशमिनां जिनागमानां श्रुति-
मुक्तिर्मत्सरिणां पुनः परिचितिनैषुएषपुण्यात्मनामृते
अन्येषां गुणसंस्तुतिः परिहितिः क्रोधादिविद्विषणाम्
पापानां विरती रतिः स्वयुद्धामेषा गतिर्धार्मिणाम् ॥१॥

“ तीर्थकरेन्ना लक्ष्मि, भूतियोगे न तमस्कार, जैनागमेतुं श्रवणु, म-
त्सदीयोगो त्याग, निषुणतावउ पवित्र थयेत्यागो विश्वय, अन्यना
युषेणानी स्तुति, क्रोधादि शत्रुयोगे न परिहार, पापेनी विरति अने स्वस्त्री
प्रत्ये प्रेम-ये धर्मी पुरुषोनां लक्षण छ.”

क्षेत्री प्रकरण.

प्रगट कर्ता.

श्री जैनधर्म प्रसारक सभा, भावनगर.

अमदाबाद—गोदो वनोक्तियुवर ग्रीनटीग प्रेस तथा जावनगर—आनंद ग्रीनटीग प्रेस.

संवत् १९६४-६५.

शाढे १८३०

सने १९०८-८

वीर संवत् २४३४-३५.

वार्षिक भूल्य रा. १)

प्राप्तेन चार आना। लेठा प्राप्तेन साथे।

હે લન્દો! અંતરંગ રાજ્યમાં પ્રવેશ કરતાં બ્રથમ શુરૂ મહારાજને તે-
નો માર્ગ પુછ્યો, પછી તેઓ કે ઉપદેશ આપે તે પ્રમાણે સમ્યક્ રીતે અ-
લુધાન આચરણું, અભિહૃતી નેમ અભિની સેવા કરે તેમ તે (શુરૂમહારા-
જ) ની સેવા કરવી, ધર્મશાસ્ત્રના પારને પાગવું અથીતું સર્વ શાસ્ત્રો વાંચ્યા
કે સાંભળવા, પછી તેમાં કહેલો તાત્પર્ય તેમજ લાવાર્થ વિચારવો, તેનો ચિ-
ત્તની સાથે નિરધાર કરવો, ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે (યથોક્ત રીતે) કિયા-
ઓ કરવી, સંતજનોની સેવા કરવી, અસંત (ફર્જન) પુરૂષોને સતત વર્જન-
વા અથીતું તેનોં સંગ ણીલકુલ ન કરવો, ચોતાના આત્મા પ્રમાણે સર્વ લુચેને
માનીને તેનું રક્ષણું કરવું, સર્વ પ્રાણીને હૃતકારી, ડેમાણ (ભિષ) અને ગ-
વસર ઉચિત સલ્ય વચ્ચન ણોલખું, આણુમાન પણ અહત થણું ન કરવું;
સર્વ સ્વિચ્છાનું સમરણ, સંકદ્યન, પ્રાર્થના, નિરીક્ષણ અને તેની સાથે લાખણ
વર્જવું, ણહિરંગ પરિથિત (ધનધાન્યાદિ) અને અંતરંગ પરિથિત (વિષ્ય-
કથાયાદિ)નો લાગ કરવો અને નિરંતર ધાંચ પ્રકારનું સંભાવધ્યાન કરવું.

ઉપભિતિ ભવમ્ભાન્ય.

વાગ્ચીક વિષયાનુકમણિકા.

વિપશી.

પાનાં

૧ શ્રી છુટો નૈન (શ્વેતામ્ભર) કેન્દ્રરસનો રીપોર્ટ.	૧ થી ૬૪ ઝ (પૃષ્ઠ ૭૧)
૨ નીળ નૈન મહિલા પરિષદ્દનો રીપોર્ટ	૬૪ જથી ૬૪ ફ (પૃષ્ઠ ૧૫)
૩ લાવનગર આતે લરાયેલા ગેતીવાડી તથા દેશી હુભર ઉઘોગના પ્રદર્શનનો છેવાલ	૬૪ બથી ૬૪ સ (પૃષ્ઠ ૧૦)
૪ ઉપરેશાક પદ. (કવિ સાક્ષણ્યંદ પીતામ્ભરરદાસ.)	૬૫
૫ સુમતિ અને ચારિનરાજનો સુખદાયક સંવાદ (મુનિ કર્મરવિજયજી.)	૬૬-૬૮
૬ ક્ષમા. (માઙ્કિતક)	૭૭-૧૧૫-૧૩૬-૧૬૨
૭ શ્રીપાળ રાજના રાશ ઉપરથી નીકળતો સાર (તંત્રી) ૮૫-૧૫૩-૨૧૫-૩૧૧-૪૦૭	
૮ સમેતશિખરલુના સંખાંધમાં છેવલા વિચારા. (માઙ્કિતક)	૬૧
૯ અવને ઉપરેશા..પદ. (અમીચંદ કરશનજી શેડ)	૬૭
૧૦ લાવનગર નૈન મહિલા પરિષદ્દમાં શુકાણ ફુણે આપેલું લાખણુ.	૧૦૮
૧૧ સ્વીકેળવણીની ઉભાતિ (યેણ બંદાવી વીરચંદ)	૧૧૩
૧૨ લાવનગરમાં થયેલો આચાર્યપદીનો મહાન ઉત્સવ.	૧૨૩
૧૩ સંસાર અસારતા. પદ. (શ્રીયુત્ ચુનીલાલ છગનચંદ શરાફ)	૧૨૯
૧૪ સુભાપિત વચનમૃત યાને ઉપરેશ રહુસ્ય (મુનિ કર્મરવિજયજી)	૧૩૦
૧૫ મોહ શું સમજાવે છે—વિદેશ શું દેખાવે છે? (તંત્રી) ૧૪૩-૩૪૪-૩૬૩	
૧૬ નૈન કો—જૈન કાયદો (શ્રીયુત્ અવરાજ ઓધવળ હોશી)	૧૪૮
૧૭ લીણઠી દરણાર “મીનુ” એક શુભ કાર્ય.	૧૫૮
૧૮ ણાણુસાહેણ રાજ વિજયસિંહજી ણાહાદુરસું ભાવનગર પધારસું	૧૬૦
૧૯ શ્રી શાંતિ જિનાસુતિ. પદ. (અમીચંદ કરશનજી શેડ.)	૧૬૧
૨૦ સુભાપિત વચનમૃત યાને ઉતામ નીતિ રીતિ. (મુનિ કર્મરવિજયજી)	૧૬૮
૨૧ નૈન સાહિત્ય પૈકી રાસો આહિના થાંથકારોની યાહી.	૧૮૦
૨૨ કરણીનાં ક્રણ વિષે. પદ. (અમીચંદ કરશનજી શેડ.)	૧૬૩
૨૩ સુભાપિત રત્નાલણી (મુનિકર્મરવિજયજી)	૧૬૪-૨૨૭-૨૬૦-૩૨૩
૨૪ સ્થિરકીરણ	(તંત્રી) ૨૧૮
૨૫ વર્તમાન સમાચાર અને વર્ત૊માન ચર્ચા.	૨૧૯

२६ सती सीताएँ रावणुने करेलो। उपदेश. पद्ध. (अभीयांह करथनलु शेइ)	२२५
२७ अंथावदोङ (अधिमंडण आधारंतर) (तंत्री)	२४२
२८ सामाजिक परिस्थिति पर विचारा (मैटिक्ट)	२४७
२९ अमवुं अने अमावुं (तंत्री)	२५२
३० छेमयंद्राचार्य तथा योगशास्त्र.	२५७
३१ पाप लीडत्व—यतुर्थ सौजन्य. (मैटिक्ट)	२७७
३२ जयाणुनी आवश्यकता. (तंत्री)	२८५-३०६
३३ शेइ वीरचंह दीपचंहनुं ऐदकारक मृत्यु.	२८७
३४ संसारमां अस्तिथरपणुनी स्थिति. पद्ध. (कवि सांकण्यांह पीताभ्यरहास)	२८८
३५ मनुष्यने मुक्त थवानो सुगम उपाय. (पंडित लालन.)	३०३
३६ वर्तमान यर्थी.	३१६
३७ व्याकुण थयेदी चेतनानो शुद्धात्मा प्रति उहूगार. पद्ध. (जैनसेवक गीरधर छेमयांह)	२८८
३८ देवमूर्जन कियाना कृष्ण संभांधी याचना (श्रीयुत सुरचंदकार्य पुरुषोत्तम हास घटामी),	३४०-३६६-३६६
३९ श्रीमान छेमयंद्राचार्य अने योगशास्त्रना देख संभांधी खुलासो.	३५२
४० प्राण यंथीने अगोध. पद्ध. (कवि सांकण्यांह पीताभ्यरहास).	३५३
४१ शानसारस्वत स्पष्टीकरणु. (मञनता-अष्टक) (मुनि कुर्पूरविजयल),	३५४-३८६
४२ श्री हिरयश्ममांथी केटलाएँक अक्षोनोत्तर.	३७६-४१३
४३ आत्म राजने चेतना राणीनो गोध. पद्ध. (कवि सांकण्यांह पीताभ्यरहास)३८५ (एकांदर पृष्ठ ४१६+३२=४४८)	

श्री जैनधर्म प्रकाश

जो जब्याः प्रविशतान्तरङ्गराज्ये प्रथममेव प्रष्टव्या गुरवः । सम्यग्नुष्टुयस्त-
दुपदेशः । विधेयाहिताग्निनेवोग्रस्तदुपचर्या । कर्तव्यं धर्मशास्त्रपारगमनं । विर्ज-
नीयस्तात्पर्येण तद्जात्वार्थः । जनयितव्यस्तेन चेतसोऽवष्टम्भः । अनुशीलनीया धर्म-
शास्त्रे यथोक्ताः क्रियाः । पर्युपासनीयाः सन्तः । परिवर्जनीयाः सततमसन्तः ।
रक्षणीयाः स्वरूपोग्रमया सर्वजनत्वः । ज्ञापितव्यं सत्यं सर्वज्ञूतहितमपरुपमनतिकाले
परीक्ष्य वचनं । न ग्राशमणीयोऽपि परथनमदत्तं । विधेयं सर्वासामस्मरणमसंकटप-
नमप्रार्थनमनिरीकृणमनज्जिज्ञापणं च स्त्रीणां । कर्तव्यो वहिरङ्गान्तरङ्गसङ्गत्यागः ।
विश्रातव्योऽनवरतं पञ्चविधः स्वाध्यायाः ।

उपमितिज्ञवप्रपञ्च.

भुस्तक २४ सु. वैद्र. सं. १६३४. शाके १८३०. अंड १ लो.

वर्षारंज्ञे मांगढ़्य स्तुति.

३१८.

ज्य विनवर ज्यवंता, शुद्धवर ज्यग्ना गणेश शुणवंता;
अभ्यलयहुर लग्नवंता, विज्य झेण्यवर्पमां विज्यवंता।

कृद्विवर्यः

१) अभ्युत्त अभ्युत्त सुकेवण भुत्तन्त अभ्युत्तन्त इर्मत्ताः ।
२) अभ्यलयहुर लग्न आ लग्नना ज्यामां ज्यमना उपकारी धाणा ।

१ अद्य शुह, २ शृणु, ३ साक्षसम्भाना धर्मस्वामी, ४ अभ्युत्तवण 'सौनथी' सुशेषित
५ अंडन कर्त्तार, ६ भयने नारा कर्त्तार,

શ્રી જૈન ધર્મ પ્રકાશ.

જે શિવકારક ઉતારક આ લખવારિ નિવારક છે સુખકારી,
તે જિનનાથક દાયક શિવપદ ધર્મવિધાયક હો જયકારી. २
હર્ષદ આ નવ વર્ષ વિષે ઉત્કર્ષ કરો પ્રભુ પૂરણ લારી,
સ્વાત ૧૫દિપતાર પૂર્ણ વિકાશિત નિલ કરો જનરંજન કારી;
ધર્મપ્રકાશ કરી જિનનો જગમાં જિનશાસન હો જયકારી,
આહુક સર્વ સહાયક સુંદર અંગ ઉમંગ ધરો સુખકારી. ३

નવું વર્ષ.

શ્રી પંચપરમેષ્ઠીને વિવિધ વિવિધ નમસ્કારકરાને આજે અતુર્બિંશાતિ તીર્થ-
કરેનું લક્ષ્ય આ માસિક પોતાના ચોવીશમા વર્ષમાં પ્રવેશ કરે છે. દિવસો હિ-
વસે આચુ વૃદ્ધિમાનું થતું જય છે તેમાં અરેણરી પ્રથમ પરમાત્માની, ધીજ
ચુડુવર્ષની અને વીજ ઉત્તમ લેખકાની કૃપાજ કર્યકારી છે. મહુંયો આચુષ્યમાં
વૃદ્ધિ પામે છે લારે વાસ્તવિક રીતે તે લખ સંબંધી આચુષ્યમાં હાનિ પામે છે-
ઘટતા જય છે, પરંતુ મારા (આ માસિકના) સંબંધમાં એમ નથી. હું તાં
વૃદ્ધિ પામું છું તે વૃદ્ધિજ પામું છું, તે પણ એક પ્રકાર નહોં. સ્વહિતમાં, પર-
હિતમાં, સંસ્થાનમાં, ગુણતામાં, આહુકસંખ્યામાં, વિષયસંખ્યામાં, લેખકસંખ્યામાં
અને પ્રાંતે સુહસ્યસુષ્પ્રકા વિષયોવઠ એક અંથનું રૂપ ધારણ કરવામાં હું વૃદ્ધિ
પામું છું એમ તરફથ પુરુષો કહે છે. જે કે હું આટલાથી તૃસુ પામું છું એ-
મ નથી. મારી કે મારા નેતાઓની વૃત્તિજ આ સંબંધમાં અતુસીવાળી છે,
અને તેથી પ્રારંભમાન હું તમને મોહું રૂપ ધારણ કરેલ હેણાઈશ. આપા
વર્ષમાં ચોવીજ રીતે કોઈ કોઈ ખાખતમાં વિરોધ રૂપ ખતાવી અન્ય જનોની પ્રસ-
નતાનું આદર્શણું કરવા હું બનતો પ્રયત્ન કરીશ.

નત વર્ષ મારા પોતાના, મારા ઉત્પાહકના તંમજ મારી જનમલ્લિમના
સંબંધમાં ચાનંદાયક વ્યતીત થયું છે. મારા નવા વર્ષપ્રવેશની સંઘિ તો
એટલી અધી હુંપોત્પાદક છે કે આજે આચું લાવનગર શહેર અને તમામ
નૈનથિયુંચો, પુરુષો ને સ્વીઓ, બાળકો ને બાળકાઓ છુફું નૈન ડેન્ફિસના પ્ર-

૭ તાસનાર, ૮ સંસારધ્રા જગને નિવારનાર, ૯ આપનાર, ૧૦ ધર્મ કરનાર, ૧૧ કષ્યપનાર.

नवं वर्षः

३

मुण्ड साहेब शेष मनसुभाष्य कथाप्राप्तिना दर्शन करवाने उत्सुक थानी पर्युष हो; प्रथम जिनदर्शनादि करीने रेशेन तरह प्रयाणु करतुं ज्ञेवासांचावे हो. आवो अप्रतिम धर्षनो द्विस तेज मारी जन्मयथीनो द्विस छावाथी मने पछु वधारे हर्ष थाय यो द्वालालिक हो. आने प्रमुण साहेब पधारयो, स-अग्नि संघ धूर्पित थयो, अनेक प्रकारनु भान आपरो ने मेणवयो, वर्षुनां बेझो अनेक न्युजपेपरोमां प्रगट थयो, अने कैनैन धर्मनी उभति तेमज्जीति चर्व द्विशाम. विस्तार पामयो. केन्द्ररन्सथी थता अन्य अनेक प्रकारना लाभो तो खान्युपर रहो; परंतु आवी कैनैन धर्मनी उभति थवाना कारणिक थवुं ते कांड अल्प लाल नथी, अनल्प लाल हो. शाखार शासनोशतिनुं क्षण यावत् तीर्थकरनामर्कमना खांध पर्येत कहे हो.

गत वर्षमां आ मासिकनी अंदर नाना मोटा पद लेझो आवेला हो, जेमां मोटो लाग मोटो लेझोनोज हो. तेनी अंदर ११ लेझो पदवांध हो जे वांचनार खांधुओने सारी अने तात्कालिक असर करे तेवा हो. आ पदवर्यनाना मोटो लाग अमरावाही कैनै शीघ्र कुनि सांकण्यांह भीताम्भरहासनो हो. गत वर्षथी ओमनो आ मासिकना लेखकमां उमेरो थयो हो. गधवेषको ४५ पैकी ८ लेख मुनि महाराजना लेखेला हो, तेमां पछु ८ लेखो तो मुनिराज श्री कर्पूरविजयलुना लेखेलाज हो; जे लेखना संघाधमां कांड पछु प्रशंसां लगवी ते आंगे तेराण आंधवा लेखुं हो. उमडे आतरक्षी यो लेझोनी प्रशंसा आव्याज करे हो. एक लेख इट्टय प्रीति पद निशिकोनो हो, ते एक मुनिराज लेखे हो. टीका पाणु नवी अनावे हो अने गुजराती लापांतर पछु ओमा साहेबन लेखे हो. वर्षु वर्षत थईने ६ लेखो आवेला हो, आडी ३० रह्या हो. आणो लेख लापाएने आवी गथेवो छावाथी आ वर्षमां प्राप्ते ते लेख पूर्ण थर्ह ज्वा संखव हो. लेखक मुनिराजनो विचार हालमां पोतानुं नाम प्रगट करवानो नथी.

आडीना उद गच लेझो पैकी नाना मोटा १६ लेझो वर्तमान समाचार, नवीन समाचार, चाहुं नवी शहित तंदी तरक्षना अने २० लेझो जुदा जुदा विदान लेख. केनां लेखेला हो. ए लेझोना लेखक जुदा जुदा ११ गुहस्थ ऐकी एक लेखक शीशिक्षक तरीके सुरत आविकाशाणामां काम करनार भाई वाली वीरुच्यांह हो. आडीना हथ लेखको —मैक्सिक, अमरच्यांह घेलालाई, मी. लालन, मनसुभ कीरताम्ब, हुर्वलहास काणीहास, ज्वराज ओमधवलु होशी, अभीच्यांह

कुरुशत्तम्, न्यालयं ह लक्ष्मीयं ह योनी, साकुरयं ह माणेकयं ह धटी-आणी अने चुनीलाल छगनयं ह आळे. आ दैरेक लेखक जाहेर लेखक तरीके तेमज वक्ता तरीके प्रसिद्धि यामेला छोवाशी अने तेनो मोठो भाग तो आ मासिकने जन्म आपनार शेबानो अंगीभूत छोवाशी तेमना चंभंधमां कुप्त पण्य प्रशंसा लघवी ते योग्य जणाती नथी. परंतु एटलुं लभलुं जड़तनुं छे के ए लेखके कायम लेण्या आग्या कर्ती तो मारी शेबामां अवश्य अलिवृद्धि थया विना रहेणो नहीं.

आ वर्ष आणरे अरी रीते डोऱ्य पण्य विषय आपूर्व रहेलो नथी; परंतु आगण चलाववाना विषयो तरीके मोऱ शु समजवे छे ने विवेक शु देशवावे छे? श्रीपाण राजना चस उपरथी नीकागतो सार, कैनदौ—कैन दायदो, आषक्विव-रणु, हृदयप्रहीपयपत्रिशिका, सर्वमान्य कृह्याणुमार्ग, दश महा शिक्षा अने सेवान्य ए विषयो छे के ने विषयो ए वांचडेना हृदयनु अरेखडे आकर्पणु करेलुं छे. आ शिवाय गत वर्षमां डोन्हरन्सने अंगे पण्य घण्या विषयो लणवामां आव्या छे. छेलो अंक तो मात्र डोन्हरन्सना विषयो थीन लरपूर प्रगत करेलो छे. डोन्हरन्स प्रतेनी आपूर्व अक्षिणी खताववाने माटे एटलुं ज यस छे.

गत वर्षना संभंधमां आटलुं विवेचन करीने तेमज प्रस्तुत वर्ष संणार्थी दिग्दृश्यन करावीने णारा आ मासिकनी उपयोगिता खतावी आपवी एन मुख्य छेतु छे. आवा मासिको अनेक प्रकारनु छित करे छे. वांचनारने वक्ता तेमज लेखक घनावे छे अने ज्ञे ते प्रमाणे वर्तन करवामां आवे छे तो अबश्य आत्महित पण्य करी आपे छे. गङ्गे सुण शेमां छे? अने संसारमां सुण छे? एवा विषयो आ संसारनु स्वरूप आपणी दृष्टि आगण अडुं करी आपे छे अने ज्ञे विवेकहिती तेनु भनन करवामां आवे तो मिथ्या जंबला नाश पामे छे, सुणहुःभमां समान वृत्ति थाय छे अने अहिरुषिपणु टणी जह आत्महित पण्य ग्राम थाय छे. मोऱ शु समजवे छे अने विवेक शु देशवावे छे? ए विषयनो छेतु पण्य आस मिथ्या समजणुने दूर करावी अरी समजणुने आगण पाठवानो छे. आ प्राणी मोऱनी समजवटने अंगे ने के लूस करी रहेणो छे तेवी लूलो हुवे पढी न थवाने माझेन ए लेण लणवानो प्रथास छे, परंतु तेनी असर ने प्राणीनी लवण्येणी अवध छेथ, संसारश्रमणु आळुं करवानु छेथ, अने धर्म सन्सुण थेल छेथ तेनेन थायछे; धीन प्राणीने तेवा प्रकारनी असर थती नथी.

मने जन्म आपनार संस्थाने आवे राष्ट्र वार्ष पूर्ण थर्च रटनु वर्ष ऐसे छे. नवा जमानानी पद्धति अनुभार रप वर्ष थती श्रीदिवर ज्युषीली आनंदात्मवनो

નવું વર્ષ.

૫

પ્રસંગ આ સમયે હેઠળ કોણકરનસના મેળાવડાના પ્રસંગ ઉપરજ કરવાનું મુકરર કરવામાં આવ્યું છે. આવા પ્રસંગ અવચિતજ પ્રાપ્ત થાય છે. જો કોઈપણ નેન જાંસ્થાની જ્યુણીલી થવાનો પ્રસંગ અન્યો હોય તો આ પહેલોજ છે. મને પણ આ દીકરત અલંત આનંદ ઉત્પાદ કરે તેવી છે. કારણું મારી જ્યુણીલીનો પણ જોમાંજ જગાવેશ ધેખેલો છે. મને એ વર્ષ ચોછા છે, ને મારી ઉત્પાદક જાંસ્થાને એ વર્ષ વધારે છે, એટલે બન્નેના મળીને સરખાં વર્ષ થાય છે. આ આનંદાત્મક પણ જેવા લાયક થશે, પરંતુ તેનું વર્ષન પ્રારંભમાં કરવા કરતાં તે પ્રસંગ વ્યતીત થયા ખાદ લેખિનીદ્વારા જોહેર થશે, એટલે મારા વાંચકો સ્વયમેવ તે જાહી શકશે, અને મારા આનંદમાં તેઓ પણ ભાગ મેળાવશો.

હુએ આરંભમાંજ મારા ઉત્સુક વાંચકોનો વધારે વધીત ન રોકતાં મારા ઉત્પાદકોનો, જભાના અંગીભૂતોનો, આહુકર્ગનો, લેખકોનો, સહાયકોનો. અને પ્રાપ્તે આખી કૈન ડોમનો જય ધર્યી તેને મારે પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી હું નવા વર્ષમાં પ્રવેશ કરું છું, અને જેમ જને તેમ મારા આહુક્રાની, દ્વિતેજદુષ્યોની અને આપણી હેઠળ ડોમની શબ્દરચનાદ્વારા વિશેષ સેવા ગળવવા તત્પર થાડું છું. પરમાત્મા મારી ધીરજ સંજળ કરો.

તથાસ્તુ.

श्री कैलाशर्म प्रकाश.

छत्ती जैन व्येताम्बर कोन्फरन्स.

प्रभुभ साहेबनुं आगमन.

सामैयानो भव्य हेखाव.

आवकार आपवानी उत्सुक्ता.

हुणीभणी रहेदुं भावनगर शहेड.

आजे नवीन वर्षनुं प्रभाते छे, वैत्र शुद्ध एकमनी आळूदान्नके जवार छे. आणी कैन प्रज्ञा मान्यवर प्रभुभ साहेब शेठ मनसुभावाई बशुभाईने आवकार आपवानी तैयारी करवामां तत्पर थई गई छे, अने डोन्करन्सनी लव्यतामां वधारो करवानो अने ते हेतु माटे प्रथम ल्याने बाहेर कोरिला नेताने वधावी लेवानो चेतरक ग्रथास चाली रहेता छे. सूर्योदय थतां हुलरो कैनो अने अन्य डोमना गृहुस्थी रेल्वेस्टेशन तरक्क प्रयाणु करतां भालुम यडे छे. सुहर वस्त्रोथी वेष्टित थई आण, युवान अने वुद्धनां टोणेणां प्रभुभ साहेबने भान आपवा भाटे अहो तहीं होयहोइ करतां ज्ञानय छे. डोध हुकानपर तोरणो लटकावे छे, डोध भाणीने लां कुल-हार लेवा होउ छे, कोध क्षुण्यामां डोरिला सुवर्ण लेणो यांधवः मंडी गया छे, डोध क्षवलच्छो यांधे छे, कोध वावयाथी हुकानने सुयोगित करवामां रोकाई गया छे, अने डोध भीलु अनेक प्रकारनी तैयारीणो करवामां लाणी गया छे. एक तरक्की द्याशीणो तैयार थई रेशनपर आवतां नव छे, भीलु तरक्की गारीणोनी धमाधम चाले छे, वोलंटीयरोनी एक भोटी डोम स्टेशन उपर हुकर थई गई छे, अने दिवान साहेब सुधी सर्व अमलदारो अने अन्य डोमना आजेवान शहेरीणो हाजर थई गया छे, रेशनने पण प्रसंगने योज्य सीते अवन, वावदा अने हस्तवान्तरी शाशुण्यासामां आवृत्तु छे अने धराणर साय आत वागवानो समय थतां रेशननी आंदर अने बाहुर चालवा जेटीवी ल्यो पालु आकी रही नव्ही. रेशनना अविकारीण्यो पास वगर सर्वने आंदर दाखल थवानी परवानगी आणी संगवडमां वधारो केंद्रो हुतो. हुवे प्रभुभ साहेबनी स्पेशीयत देनने आवी पहेंचवानी राहु जेवामां आवती हुती. धराणर नीमेल वणते (७-८२ लेक्ल टाईमे) स्पेशीयत देन प्रभुभ साहेब अने तेमनी साक्षिना भीज गृहुस्थी अने आतुण्योने लाई रेशनमां आवी पहेंची. ते प्रसंगे नेवांटीयरो (स्वयं वेवडे) नी उलेकी तेवडी हाते तेमने आंदर आप्यो,

છૃં કેન સ્વેતામ્બર કોન્કરણસ.

૬

અને હિવાન સાહેણ વિગેરે જ્યાટક્રોર્મ ઉપર તેમને મળ્યા. પુષ્પહાર, પદે-
શવવામાં આવ્યા. છૃં કોન્કરણસના પ્રમુખ તરીકેને સુવર્ણ ચાંડ એનાયત
કરવામાં આવ્યો, લાર ખાઈ રેશન ઉપરના ફરણાર હોલમાં તેથી સાહેભને
લઈ જવામાં આવ્યા, કંબા ફેરક અમલદાર અને નગરશોડ વિગેરે આગેવાન ગુહ-
સ્થેને તેથી મળ્યા અને તેઓ શેરી વખત આરામ કે તે ફરભ્યાન તેઓને
આપડાર આપવાને પ્રોસેશનની તૈયારી ખાડાર થઈ ગઈ. અરાયર સાડા આડ
વાળે પ્રમુખ સાહેણે ફેરકેજમાં પાતાની ફેરક લીધી હતી. તેમની ખા-
ખુમાં અત્રેની રીસેઝન કરીટીના પ્રમુખ વોરા હુડીસંગ અવેરચંડ અને
શોઠ જમનાલાઈ ભગુલાઈચો ફેરક લીધી અને જામી આનુચ્ચે બન્ને ચીછ સેક-
દરીએચ શા. કુંબરણ આણું ટળ અને વોરા જુહાલાઈ સાહરચ હે અને વોરા અમરચંડ
જસરાને પાતાની ફેરક લીધી. પ્રોસેશનની શોલા અવર્ણનીય હતી. પ્રેમ સારાં
અને જરીવાળાં ડાક નિશાન ચાલતાં હતાં, તેની પછ્યાડે કેન માંગવિક ચિન્હ
ઇન્ડ્રાખજ ચાલતો હતો. લારપદી કેતાલના પાંચ હુથીએ મંદ ગતિએ ગમનકરતા
હતા અને ખ્યાને, પાદણી, તાવહાન વિગેરે શહ્રયની ઉત્તમ વસ્તુએ તેની પછ્યાડે
ચાલી શોલામાં ખાડુ વધારો કરતી હતી. વચ્ચે વચ્ચે જોડેલાં બેન્ડનો સુંદર અવાજ
માલુમ પરતો હતો. હુથીના હોદ્દાપર શોઠ મનસુખભાઈના પુત્ર માદુલાઈ અને લાલું
માદુલાઈએ ફેરક લીધી હતી. પંચીતુરતાજ વોલંટીયરીના જનરલ સુપ્રીનેન્નની શા.
તરીતમદાસ ભાણુણ પાતાના પાંચ સુપ્રીનેન્નનો સાથે વોલાપર મેસી ચોતરે
દેખરેખ સાખતા હતા અને તેઓની પછ્યાડે લગભગ શાદા ચારસે વોલંટીયરીએનું
લશકર ચાલતું હતું. ચા શોલા અવર્ણનીય હતી. છેવટે પ્રમુખ સાહેભની જાડી
અને તેણી પછ્યાઢે ખીન ગુહસ્થેની આડ જાડીએ ચાલતી હતી. પ્રોસેશન દાખ્ય-
બળર, ખાંડર ફરવાન અને મેટીબળરમાં થઈ જોધાના ફરવાનના રસ્તે મેટીબળ
તરફ થઈ નાકુણાગ જવાનો હતો અને તે માટે આખો રસ્તો પાણીના છાંટકાવ
અને વાવટા તારણુથી છવાઈ ગયો હતો. અને પાનુચ્ચે નેનાર સ્વીપુરુષોની
હારની હાર થઈ ગઈ હતી કેમાંથી રસ્તો મેળવ્યો પણ ખાડુ સુરક્ષાલ હતો. આંખે
રક્તો પ્રમુખ સાહેણને અન્નાધારણ માન મંજું હતું અને હાર તથા ગજરાથી તેઓની
જાડી ચીકાર લરાઈ ગઈ હતી. તેઓ સાહેણે ખાડુ જગોચ્ચેથી માન આપવામાં
આવ્યું હતું, તેમાં સુખ્યત્વે કરી કેન શુલેચ્છક પત્રના અધિપતિ, વોરા અમરચંડ
જસરાજ, વોરા હુડીસંગ અવેર, શ્રી આતમાનંદ કેન સલા, શા: આણું ટળ પુર-
ગોતામ, શ્રી કૈનધર્મ પ્રસારણ સલા, નગરશોઠ પરલુદાસ લગવાનડાસ, શા રત્નશ્ર

શ્રી જૈતબર્મી મંડાણ.

વીરજી, શ. વિલુષ્ણનદાસ ભાણુલી, શ્રી સંધ, શ્રી વૃદ્ધિચંદ્રજી કેન વિદ્યાશાળા, શ્રી ઉજમણાઈ કેન કન્ચાશાળા વિગેરે વિગેરે અનેક સંદ્ધથાંચો અને ગૃહુસ્થો તરફથી અસાધારણ રીતે માન આપવામાં આવ્યું હતું અને સર્વ જનોના હૃદયમાં આઝ્ઞાદ પણ અપૂર્વ હતો. પા માઈલનેટલું અંતર પસારકરવામાં સવાએ કલાક થયા હતા, અને લગભગ અણિયાર વાગે પ્રોસેશન નાટું ખાગમાં પણેંચ્યો હતો. અત્ર પ્રમુખ સાહેણ પણેંચ્યતાંજ ડિવાન સાહેણ દર્રીવાર મળવા આવ્યા હતા અને અરસ્પરસ લાગલી ખતાવનારા શઘણો ઉચ્ચારી આલાર માન્યો હતો. પ્રસંગને અનુસરતું વિચેન શાસ્ત્રી નર્મદાશ કર દાખેદરે પણ કર્યું હતું. આ દિવસનો અભ દેખાવ દરેક કેન વ્યક્તિના હૃદયમાં કોરાઈ રહેશે એ રવાલાવિક છે.

દેલીગેટોનું આવાગમન, મોટી સંખ્યામાં હુનરી, ખી વીઝીટોની સગવડ, રસેભન કમીટીએ કેરેલી ઉતારા બોજનની સગવડ.

પ્રમુખ સાહેભનું ચેત્ર શુદ્ધ એકમે આગમન થયું તે હિવસ સવારે, અપોરે, સાંને અને રાત્રે મોટી સંખ્યામાં દેલીગેટો આવવા લાખ્યા, તેચ્યાને આવકાર આપવા રેલ્વે રીસેબન કરીઠીના અલાસ્થો હુનરી રહેતા હતા, અને વોલાંદીયતાના સુચીનેટનેન્ટ શા. પ્રેમચંદ રતનનું પોતાની કુકી સાથે સ્ટેશનપર ડેંપ નાળી દરેક દેન વળતે હુનરી રહેલાજ હતા. રેલવેના દરમાં કન્સેબન, શયુંદ્યની સાન્નિધ્ય અને લાવનગર તરફ સ્વાલાવિક જેંચાણુંને લીધે દેલીગેટો પણ સંખ્યામાં હુનરી થવાનો અભિવ હતો, અને તેમને ચારું ઉતારની વ્યવસ્થા કરી રાખી હતી. હુનરા ઉતારણો માટે દેસસર પણ જુદા સ્થાપવામાં આવ્યા હતા અને ઉતારણો રીપિર કરાવી ખાસ તિયાર કર્યો હતા. પરંતુ દેલીગેટો સાથે બેશચ્ચો અને છોકરાચ્ચો અને તે ઉપરાંત મોટી સંખ્યામાં વીઝીટોની ઉતરી પદવાથી બોજને હિવસે ઉતારની વ્યવસ્થા કરવાનું કર્યું અદુજ મુશ્કેલ થઈ પડ્યું. તરફાળમાં બીજી મોટી જગાણો માળી લઈ બનતી વ્યવસ્થા ઉતારાક્રમીઠી અને ચીકું સેકેટરીઓણે કરી, તો પણ ધાર્યા કરતાં માણુસ વણું ગણું થઈ જવાર્થી સર્વને કર્તોપ આપવાનું બાંની શક્યયું નહીં હોય એ અનવા જોગ છે. એકમ અને બાજે ચાલુ ચાર ટ્રેનો આવવા ઉપરાંત ચાર અને છ રેલેશનીયત ટ્રેનો આવી અને દરેક દેનમાં લગભગ બેવઢી જાણીએ. આવવા લાગી, દેન આવતી વખત વોલાંદીયતોના આવાજ અને સ્ટેશનનો

છુટી જૈન સ્વેતામ્બર કોન્ફરેન્સ.

૯

હેખાવ આકર્ષણીય થઈ પડતો હતો. જનરલ સેક્રેટરી મી. ડાન અને શેડ વાલભાઈ માટે ખાસ ઉત્તાર રાખ્યા હતા, શેડ વીચ્યંદ દીપચંદ પોતાના સનેહી માણ્યદીવાનપુર રાચભાઈને ત્યાં ઉત્ત્યો હતા અને શેડ પુનર્મચંદ કરમંચંદ તથા બાજુ માણ્યદીલાલલુ માટે જુદા ઉત્તારાની ગોડબણુ કરી હતી. સ્વી વીજીટરોની સંખ્યા પણ ખાલું થઈ હતી અને દશ દિવસથી ટીક્ઝીટ આપવાનું કામ બાંધ રાખ્યું પડ્યું હતું, છતાં છેહ્મી ધરીએ પાંચસે ટીક્ઝીટ વધારે કાદવાની અને તે માટે ગોડબણુ કરવાની જરૂર પડી હતી. લોજન માટે ઉત્તારથી તાદ્દન અસગ જગ્યા રાખી હતી. એ મોટાં સ્ટોડાં રાખ્યાં હતાં, ન્યાં ટેલીગ્રેન્ની સંગ્રહ જાળવવા પૂરતો પ્રયાસ કર્યો હતો. લોકોની મેહની એટલી જરી હતી કે ચૈત્ર શુક્ર વીજની સંકે શહેરમાં ગાડી ચલાવવી પણ મુશ્કેલ થઈ પડી હતી.

વિજો-તેમને દૂર કરવાનો પ્રયાસ: ટેલીગ્રેન્ની મોટી સંખ્યાને પહોંચી વળવાની ગોડબણુ કરવા ઉપરાંત જવાખાર કામ કરનારાએને બીજુ આખરોમાં બહુ ધ્યાન ચાપવું પડતું હતું. મહુવા પાલીતાખાનાને સ્થાનિક તકરાર કેટલીક જેરસમનુંતી ઉમા કરી કલાક કરવે તેવાં ચિનહે હેખાડતો હતો, અને તેથી તે સંખ્યામાં સમજાવટ કરવાનું મહાન કાર્ય પન્યાસલું શ્રી નેમ-વિજયલુ સમક્ષ ચાલતું હતું. આ આખી સ્થાનિક દિલ્લીએ અતિ મહત્વની હોલાથી કાર્ય કરનારાએને તે સંખ્યામાં પણ ખાલું કાળજીએ કરવો, પડતો હતો. છેવટે આગેવાનોની સમજણુ અને ઉક્ત મુનિજિન્ની પ્રેરણાથી કલાક શાંત થયો હતો. બીજુ અગવઢ ધણા વખતથી ચર્ચાતા કચ્છીલાધર્યાના સવાલને લગતી હતી. તેઓનો વિચાર શેડ આખુંદળું કલાખાળની પેઢીનો હિસાબ છીપાવી બહાર પાડવાનો, પ્રમુખે ડારોના સંખ્યામાં પ્રતિશા લેવાનો અને પ્રમુખની દરખાસ્ત પર સુધારો સુકવાનો હતો. ચીંક સેકેટરી પર તે સંખ્યા તેમણે લખાણુ કર્યું હતું; પરંતુ રિસેપ્શન કમીટીએ એકમતે સ્વીકારેલા પ્રમુખની દરખાસ્ત પર સુધારો સુકાય તો આખા શ્રી સંઘને, પ્રમુખને અને જૈન કોમને અપમાન કરવા જેવું થાય અને કહાય સુરતના હેખાવતું પુનરાવર્તન થાય એવો. ભય બહુ માણુસોના મનમાં હતો, તેથી એક આનગી મીરીંગ કરી તેમાં શેડ વીચ્યંદલાઈ, મે. ડાન સાહેબ, દામેદર ખાપુશા, કુંવરલુ આખુંદળુ, જુઠાલાઈ અને બીજા આગેવાનોએ કચ્છીલાધર્યાએ સાથે વાત કરી કરાવના મુસદામાં ચોડાક ફેરફાર કરી તે પ્રમાણે સરળેકટ કમીટીમાં મૂકવા ગોડબણુ કરી, અને તેથી તે સંખ્યા વાદળ તરતમાં દૂર થયું. આ ઉપરાંત બીજા સ્થાનિક

૧૦

શ્રી કૈન્દ્રીયમે પ્રકાશ.

અને પરદેશ સંબંધી અગત્યના અથવા નાના સવાલો તરફ એહુ ધ્યાન આપવાતું હોવાથી ઉદ્વિજેટોની સગવડતાના સંબંધમાં નેચું તેટલું ધ્યાન ચીકુ સેકેટરીઓથી આપી ન શકાયું હોય એ અનવા નોંધ છે. શાસનની ઉભાતિ કરવાની શુદ્ધ હોવાથી અર્વ વિધેના દૂર થયાં અને ચૈવ શુદ્ધ વીજતું માંગલ્ય પ્રભાત સૂર્યનાં લાલ કિરણું કેંકનું અર્વને પ્રાપ્ત થયું. લાંઘા. વખતથી એ દિવસની રાહ જોવામાં આવતી હતી તે પ્રાપ્ત થતાં તેને માટે તૈયારી થવા લાગ્યી.

પ્રથમ દિવસના કાર્યમાં પ્રવેશ કરીએ તે પેણલાં જુહી બુહી કર્માણિઓએ કેવા પ્રકારની તૈયારીઓ કરી હતી તે પર જરા નજર ફે઱વાની યુક્ત ગણ્યાશે. કેન્દ્રપેદ-નન્દસ કર્માણિએ પગવદુહાર ચલાવી એહુ કાર્ય કર્યું હતું. ડરાયો કંવા પ્રકારના લેવા તે સંબંધમાં સર્વની અભિપ્રાય માણયો હતો અને તે સર્વના નિષ્કર્ષ કારી હરાવેનો અરદ્ય તૈયાર કર્યો હતો અને તેની પાંચસે નકલો પ્રથમથી મોકલી આપી હતી. આથી સણનેકર કર્માણનું કાર્ય એહુ સરળ થઈ પડવા સંભવ હતો. તે ઉપરાંત કાદિવાવાઠના આગેવાનોનો હુનિકારક રીવાળેના સંબંધમાં અભિપ્રાય પુછી કેટલુંક વ્યવહાર કાર્ય કરવા ધારણા રણી હતી, એ ધારણા સર્વાંશે કુલીભૂત થઈ શકી નથી, તો પણ હજુ તે સંબંધી કાર્ય આગળ ચાલી શકે તેવી સ્થિતિમાં છે, દીક્કાટ કર્માણિએ દૈક્ક ગામબાળાને પ્રથમથીજ દીક્કાટ મોકલી આપી હતી અને તેથી નાના દિવસોમાં એ જોગણો થાય છે તે થવા સંભવ નહોંતો. હેઠળ કર્માણિએ દવા વિગેરની સગવડ કરવા જોડબણું કરી હતી અને કન્નેદીજીજન્ના કર્માણિએ પોતામાટે એક નાંના તાંબુ મંડપની ણાનુમાં ઉલ્લાં કર્યો હતો. સાપ્લાઈ કર્માણિ પોતાના કાર્યમાં ધારણા દિવસથી તત્પર રહી હતી અને મંદ્યપ કર્માણિનું કાર્ય એક માસથી શરૂ થઈ ગયું હતું. રેલ્વે સ્ટેમર કન્નીનીયન્ના કર્માણિએ પ્રયાસ કરી જોગણો અર્દોઠા, ભાવનગર તથા આઉથ શહીલબણું વિગેર રેલ્વેનું તથા સ્ટેમરનું લાડા માટેનું કન્સેશન મેળવી એહુ સગવડ વધારી હતી. આવી રોતે સર્વ કર્માણિઓ પોતાપાનું કાર્ય ઉમંગથી કરતી રહી હતી, અને કેન્દ્રનન્દસના દિવસો નાના આવતાં કુલણા મેંથરો પોતપોતાનાં કાર્યોમાં ચીવરથી જોડાઈ ગયા હતા.

ચૈવ શુદ્ધ વીજ શનિવારની પ્રભાતીં આપા શાહેરમાં આનંદ પ્રસરી રહ્યો હતો. જમાનો વખત અગ્યાર કલાકનો હોવાથી સર્વ હેવદર્શન, મૂળ તથા પુરુષદ્વારાની કરી લોજન લઈ મંડપ તરફ પ્રયાણું કરતા હતા. છેદ્વી ઘડીએ સ્વીણાની સંચારમાં પાંચસેનો વધારો થવાથી મંડપ કર્માણિ અને વેલનીયરોના

છૃ જૈન શ્વેતામ્બર કોન્કણસ.

૧૧

કાર્યમાં કેટલીક સુરકેલી ઉલ્લિ થઈ હતી. મંડપ સંમુખ આવતાં તેની લભ્યતા લેઈ સર્વને આનંદ થતો હતો. ગોધાના દરવાજા ખાડાર આદિષ્ટ રકેવરમાં થાહુ વિશાળ મંડપ નાખવા માં આવ્યો હતો, મંડપની લંબાઈ ૨૧૫.૫૪ અને પ્રેક્ષકો સગવદથી ગેરીઝી શકે તેવી ગોડવણુ કરવામાં આવી હતી. મંડપમાં દાખલ થતાંજ પ્રથમ નાનો તંબુ ટીરીએ કમીરીનો આવતો હતો, જે કમીરીએ ડેવીગેટોની અગવઠ સારુ પોતાની એપીસ લાંબ રાણી હતી. મંડપની આનુમાં જનરક સેકેટરીઓનો, પ્રમુખ સાહેબનો, ચીક સેકેટરીનો, ઇન્ફેલીજન્સ કમીરીનો, ટેલીથ્રાઇઅતાનો અને કોન્કણસ હેઠ ગોદીસનો—એ પ્રમાણે તંબુએ આનુકૂમે આવ્યા હતા, અને તેની આગળ પાણી પીંચા માટે ખાસ ગોડવણુ કરવામાં આવી હતી. મંડપની ધારી ખાનું વોલ ટીરીએ તંબુ આવેલો હતો અને પછવાએના લાગમાં સીએમ્એ માટે ખાસ તંબુ તથા ટીરીએ ઉભી કરવામાં આવી હતી. તેને માટે પાણીની ખાસ બુરી ગોડવણુ હતી. મંડપમાં દાખલ થતાંજ તેની વિશાળતા અને લભ્યતા જણાઈ આવતી હતી. સુખભાગમાં દીલા વેલાઓનાં કુંદાંએ ગોડવેલાં હતાં, બળીએ જનાવી દીપાં હતો, અને લભ દરવાજો કરેલો હતો. મંડપની સામે પ્રમુખ સાહેબ અને જાનવાંતા ડેવીગેટોની એકો એલાટ્રોનિક ઉપર ગોડવીહુતી અને તેની એક આનુંચે સ્ટેટના અમલદારો માટે બુરી ગોડવણુ રાણી હતી. સીએમ્એ માટે ગોડવણુ એલાટ્રોનિકની જાને આનુંચે રાણી હતી અને વક્તાએ માટે વચ્ચે છ રીટ ઉચ્ચા મંચ બાંધવામાં આવ્યો હતો અને તેને કનુંણા વિગેરથી શાશુગારવામાં આવ્યો હતો. સુાન મહારાજાનો માટે નવ કુટઉંચા મંચ બાંધી તેની શોલામાં વધારે કરવામાં આવ્યો હતો. ફેરક વિલાગના ડેવીગેટો માટે નંંદાર વાર એકો ગોડવી દેવામાં આવી હતી. મંડપની ઉપર આનું આનું અને ચોટારક ક્વિન્યુપતાકા ઇરકી રોહિંદ્રા હતા અને મંડપની અંદર પણ વિચિત્ર પ્રકારની શોલા કરવામાં આવી હતી. ડેવીગેટોની સંખ્યા હજા થાહુ વધારે હતી. કુલ સંખ્યા ૪૨૦૦ ની થઈ હતી.

આ ઉપરાંત ઝી વીજીટરોની સંખ્યા ૨૦૦૦ની હતી અને સ્ટેટના અમલદારો, દીસેપ્શન કમીરીના મેળદારો વિગેરની સંખ્યા ૮૦૦ લગભગ હતી. કોન્કણસના કાર્યને મહદ કરનાં અને કામ કરનારાઓમાં ઝી પાસ અને વર્ષમેન પાસ આવ્યા હતા તેની સંખ્યા લગભગ ૪૦૦ હતી. કુલ પ્રેક્ષકોની સંખ્યા દર્શ હુલરથી એપીઝ ગણાય નથી.

प्रथम हिवस चैव शुद्ध उ शनिवार तारीख योथी अभिलना अग्न्यार वागे ऐकीजेठे विग्रहेन मंडपमां दाखल करवामां आव्या अने भोटी संख्याने लाई तुरतज मालुम पडयु' के व्यवस्था करवा भाटे प्रभाग अयासनी ज़्ज़र छे. १६ाट-झैर्म पर प्रमुख साहेबांची इणी बाबुंचे मानवांता परेण्यांजो ऐक लीधी अने जमाणी बाबुंचे स्टेटना अमलदारेचे ऐक लीधी. कार्य शुद्ध थवानो वगत थतां वोरा अमरस्यं ह जसराज, शा गीरधरलाल आणुंदल, शेठ रतनल वीरल, शा प्रिलुपनदास भाषुलुनुं उपस्थितेश प्रमुख साहेबने लेवा भाटे तेमने उतारे गऱ्यु; अने प्रमुख साहेब भराभर एक वागे पधार्या, ते वगते तेमने अत्युत्साहुथी भान आपवामां आव्युं अने तेवीज दीते जनरल सेकेटरीचो आवतां तेमने पालु भान आपवामां आव्युं. प्रमुख साहेबनुं आगमन थतांज कार्यनी शुद्धआत करवामां आवी.

शुद्धआतमांस्थानिक चीक सेहेटरी शा कुंवरल आणुंदलुचे मंगणाचरण कऱ्यु, अने ते पछी अवेना श्री संघ तरक्थी अगट थेवेली आमंत्रणुपत्रिका वांची संलग्नावी. ए कार्य थई रह्या पछी तुरतज मंच उपरथी प्रथम भाणकोंचे अने पछी आणाच्याचे गायन गावातुं शुद्ध कऱ्यु. दश मिनिट थया पछी लावनगरना नामहार महाराज साहेब श्री लावसिंहल घडाहुर अने भडेश्वान हिवान साहेब प्रभाशंकरबाई पत्रणी पधार्या. तेमने आणी समाजे घुहु हुर्फथी पधावी लीधा. आणाचेना गायनमां तिलक करवानो प्रसंग आव्यो; ते वगते शा कुंवरल आणुंदलुची पुन्ही अने बडेने प्रमुख साहेबने मंगण तिलक कऱ्यु अने तांहुल तथा पुण्येची पधावी लीधा. गायनो नीचे प्रभाषे गवायां हुतां—

आवो साहेबी लुवनेश्वरीना—अे राग।

आज उमंजे (२) लावनगरमां भारत संघ भज्यो भारी.

अतिविष्ठरंगे, चढते रंगे जैन शासननी अविहारी; ऐक.

लावनगरनी शेवा भारी, अलकापुरी गध नल हारी;

लावसिंहल लूपति भारी, रामरान्य नीति निरधारी,

ऐक पत्नी नत ऐक नवीकारी ग्रन्त पुन युवी धारी. आज.

शेठल मनसुभलाई पधारी, आभारी ईधा लारी;

आज प्रमुणपद ऐक न्यीकारी, मंडप शेवा शणुगारी;

जैन बंधुनी क्षिति सुखरवा, जेन मन उतिलारी. आज.

छट्ठी जैन श्रवेताम्भर कोन्फरन्स।

१३

जैन ज्ञानवर्धक द्विकांश्यामी, औपधिक्यामा उर्दी सारी;

ज्ञानहान ने लुभित धनथी, श्रिति जगमां विस्तारी;

जिन आगग ने किन मंहिरना, छलेण्डिद्वार कथो लारी. आज.

ठडा धैर्य धरने खांधी, गाल याही पहेला चारी;

संग बीज ढायुँ इणविमां, थयुँ तड शाणा विस्तारी;

सांकण्यांह मीडां इल आयो, जैनश्रवेताम्भर नरनारी. आज ७मंडी.

श्री शंखेश्वर भाष्वर्व किनेश्वर, जग ज्य मंगलकारी,

धरण्डोंद्र पमादती हेवी, स्फुर्य करो सुषुप्तकारी;

आके आनंदे धन्य धरी ज्यकारी, कोन्फरन्स गविडारी. आजे. १

जैन श्रवेताम्भर कोन्फरन्सनी, छटी ऐडे आके;

थुर्जर सोरठ गंग मङ्गधर, हक्षिणुना जन राजे. आजे. २

सोरठ हेवी भावनगर शुल, जैन पुरी अदगेवी;

जैन श्रवेताम्भर कोन्फरन्से, ऐडक लीधी घेडवी. आजे. ३

जैनोनी उत्तिति करवा, थायो सरस सुधारा;

व्यवहारिक धार्मिक डेणवाणी, तेना नियम थनारा. आजे. ४

श्रद्धावांत विवेशी गांधीर, राजनगर अवतारी;

मनसुषुप्तलाई भगुलाई सुश्रावक, प्रभुण पहवी धारी. आजे. ५

तन मन धनथी जैनोत्तिमां, प्रथम पगलुँ लर्शो;

कोन्फरन्सनुँ शाम घगलवी, ज्य लक्ष्मी अट वरशो. आजे. ६

जैनोत्तितुँ लघयु साझे, प्रभुभनुँ वंचायो;

झेण्ही लेवी रडेण्ही रहेवा, अत्य डरावो थायो. आजे. ७

वीर किनेश्वर अडतो थधने, पाढा पग नहि लाच्छो;

भुद्धिसागर शूरा सज्जन, मंगणमाणा वरशो. आजे.

८

શ્રી કૈનથને પ્રકાશ.

કૈન કોન્ફરન્સ આજ ગાળ રહી, ગાળ રહી જન

ગણવી રહી. કૈન,

આપ્તિ.

હેશ દેશના આવકો, આબા ધરી ઉત્તોસ;

કૈન ધર્મ દીપાવા, કરતા વિવિધ પ્રયાસ.

ધર્મ અનુન હીં ધારને ગાજતા, સુમતિ રદ્દાય

ચિત્ત શોભી રહી. કૈન. ૧

મંડય રથના ખાડુ બની, જાણે સુર્ગ વિમાન;

વિજય વાવર્ટા ઇર્સ્કતા, ઇર્સર કરતા ગાન.

સુખસાગર ભય લેદેરે ઉછ્લે, શોભા સંસ્કરની

ન જય કહી. કૈન. ૨

દશ દિક્ક શીર્તિ વિસ્તરી, કોન્ફરન્સની આજ;

શાસન દેવની રદ્દાયથી, સુધરશે શુલ કાજ.

નત્ય વિચાર સંધ મનમાંડિ આવદો, મુષ્ય ઉદ્ઘય

આજ પ્રેમે લહી. કૈન. ૩

અદ્રિ સિદ્ધિ સુખ મણો, પામો ધર્મિક જ્ઞાન;

યુદ્ધસાગર સંપદી, થાણે સહુ કલ્યાણ.

જય જય મોલો જિન શાસન દેવની, શાંતિ કલ્યાણમથી

થાયો મહી. કૈન. ૪

ગાયનો ગવાઇ રહ્યાં બાદ અતેની દીસેખન કરીના પ્રમુખ વોરા
હડીસંગ જવેરચંદે સ્વાગત આપનાં લાખણ વાંચવાનું શરૂ કર્યું. તેમણે થોડો
ભાગ વાંચ્યા બાદ ખાડીના ભાગ વોરા અમસચંદ જસરાજે વાંચયો હતો. ભા-
ડીની ભાગ નીચે ગમાને છે—

વોરા હૃઠીસંગ ઝવેરચંદનું ભાષણ.

૧૫

સ્વાગત કમીટીના પ્રમુખ

વોરા હૃઠીસંગ ઝવેરચંદનું ભાષણ.

— ८२ —

પરમ કૃપાળું મુનિ મહારાજાંઓ, નેક નામહાર મહારાજ સાંહબ, સ્વધમોંત્રયાચી બંધુઓ અને બેણોનો તેમજ અન્ય સદગૃહુસ્થો! આજે આ સલામંડપમાં એ આનંદહાયક ઝરન મારે અનુવાની છે, તે શ્રી લાવનગરના શ્રી સંધ તરફથી નીમાખેલ આવકાર દેનારી કમીટીના પ્રમુખ તરીકે, આ રમણીય મંડપમાં જિરાનેલા સમય ભારતવર્ષીય કેન કોમના પ્રતિનિધિઓને હૃષ્યુક્ત આવકાર આપવાની છે. પ્રતિનિધિ સાહેબોએ શ્રી લાવનગરના સંઘના આમંત્રણને માન આપી લંબી મુસાઈરનો અમ વેડી, પૈસાનો અને સ્વાર્થના લોળ આપી તેમજ તેવી ખાળ અનેક અદ્યાંથી કોગવી અમારા આ શહેરની શોલામાં વધાર્યા કર્યો છે અને હીપાંબું છે. માંદ દું આપ પદારેલા તનામ બંધુઓને અમારા આશોદરના સકળા સંધતરફથી સવિનય અપૂર્વ પ્રેમથી દિવોળની ભર્યો આવકાર આપું હું. અમારું આ લાવનગર શહેર સંખત ૧૩૭૨ ની સાલમાં હુલના રાજ્યકર્તા અમારા નામહાર મહારાજ સાંહણના વડિલોએ વસાંબું તે સમયથી અત્યારસુધી ગાશહેરની તેમજ અત્યંતના કેન સંધની વ્યાપાર, કળાકૌશલ્યતા અને ધાર્મિક વૃત્તિમાં દિનપ્રતિદિન વૃદ્ધિ હતી આવેલી છે; તે સિવાય આપણું ચૈત્યો તીર્થીકર લગવાનની અનેક લભ્ય મૂર્તિ-ખાથી સુશોભિત હોઈ આ શહેરને હીપાવે છે, તેમજ ઉપાશ્રો, બોર્ડિંગ, પાંજરાણ, સલાંચા, પાદશાળા, ઉન્યાશાળા વિગેરે એ કે સંસ્થાઓ અમારા આશહેરમાં નિબંધથી પામી છે અને શારી સ્થિતિ લોગવે છે તે અને વિચરતા મુનિ મહારાજાને આલારી છે. અમારા આ શહેર ઉપર મરટુમ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્ર હુરાજ અને પાદિતવર્ય શ્રીમહુ વિજયાનંદસુરિ (આત્મારામણ મહારાજ) ની હૃદ્દુપાથી એ શુલ્ષીજ આ શહેરની કેન કોમમાં ધણું વખતથી રોપાયેલું છે, ૧૩૩૫ અત્યારે કેન કોમમાં એ જાહેરલાલી છે તેજ છે. અમારું આ શહેર એવ રિદ્ધાચળજીની નાલકમાં આવેલું હોઈને, અતે વસનારી કેન કોમને ધર્તિચિત્પ-પવિત્ર તીર્થરાજની સેવા કરવાનો એ અમૃત્ય લાલ મળો છે, તે સાથે હિંદુસ્તાનના ગ્રા સંધની સેવા કરવાનો આ વર્ષે એ અપૂર્વ લાલ મળ્યો છે તેર્થી અતેનો શ્રી અપૂર્વ ચાનંદ પામે છે. આપને વિહિત હુશે કે આપણી વ્યવહારિક તેમજ

ધાર્મિક પ્રવૃત્તિ એક વખતે પ્રાચીન કાળમાં ઘણી ઉચ્ચ સ્થિતિ લોગવતી હતી, જે અત્યારે અવનતિને પહોંચ્યી છે, અને તે સાથે ધાર્મિક અને વ્યવહારિક યુધનાં ઘણું ચાધને તુટી પણાં છે. તે સાધનો ફરી પ્રાપ્ત કરવા અને સુધારવાને માટે તેમજ જન્મને પ્રકારનાં સુખનો સરલ માર્ગ શૈખવાને માટે આવા મહાન् મેળાવણ સિવાય આ કાળમાં ડોઈ થીને સરલ અને સારી રસ્તો માલમ પડતો નથી. આવી સાગથે ઉજતિના શિષ્યદે પહોંચ્યા માટે કેટલાક વખતની અને સ્વર્ગ ઘણની આવશ્યકતા છે. જેમ નાનાં નાનાં અરણાં એકાડાં થઈ એક મોટી નહીં ખણી બાય છે, વળી જેમ જીવન જીવન ગુદ્ધસ્થ પાસે થોડા થોડી રૂપીઆ હોય તેના કરતાં ઘણા માણસેના રૂપીઆનું એક મોટું ભાડા એકાડું થવાથી એક મોટી બેંક કે પેઢી બની કરોડા રૂપીઆ પેઢા કરે છે અને તે જેમ રહ્યે રહ્યે થાય છે, તેમ વિવિધ વિચાર અને બળ બુદ્ધિવાળા મનુષ્યો એકની થઈ પોતાનાં બળ બુદ્ધિ અને પેસાનો ઉપયોગ એક સાથે એકાડો કરતાં જેમ સમર્થ થઈ બળ નમે છે અને તેવણે મોટાં મોટાં અને કઠળું કસો ઉત્તમતા અને સરકતાથી સાર્વી શકાય છે રેમ આનું સમન્બ હિત કરવાને સુદૂર અને ખણની પૂરી જરૂર છે. પરંતુ તેવું બળ ધીમે ધીમે વધતું બાય છે એમ આપણું આગદી ભરાયેતી દરેક કેન્દ્રસંસના અવદેહન પરથી અને તેમાં થતા ઠરાવેના થતા જતા અમલથી ચમણું છે. કેન્દ્રસંસે અત્યારસુધીમાંથાં થાં કંઠીં કંઠીં છે તેની હુંકી નોંધ જણાવવા રજી લઈ છું.

કેન્દ્રસંસે અત્યાર સુધીમાં કરેલ કામનું અવદેહનઃ સહશુણી બંધુઓ! કરાય કોઈ બંધુઓ એમ વિચાર કરતા હોય કે પાંચ વર્ષમાં કેન્દ્રસંસે શું કર્યું? તો તેના જ્વાળમાં અગારે એટલુંજ જણાવવાનું છે કે ખાળાક જન્મીને તરત જેમ કાર્યવાહુક અનતું નથી, પણ તે જેમ જેમ ઉમરે વધતું બાય છે અને તેને બળ આવતું બાય છે, તેમ તેમ તે મહાન् કાર્યનો કર્તી થાય છે; તેવી રીતે આ પાંચ વખત મળેલ કેન્દ્રસંસને લીધિ આપણી કેમમાં કે લગૃતિ થઈ છે તેના અનેક પૂરાવા છે. તના દાખલા તરીકે કેન્દ્રસંસ હુયાતિમાં આવ્યા ણાદ મારવાડ, મેવાડ અને થીને સ્થળો કેટલાક અણોદ્ધાર કરવામાં આવ્યા છે, તેવીજ રીતે જેસં લમીર, પાટણું, ખંભાત, લીંબંડી વિગેર શહેરેના પુરાતની ભંડારેની ગ્રીપ થઈ છે, કે આપણું હેરલ માસિકમાં છપાઈ પણ ગયેલ છે. વળી તેવીજ રીતે કેળવણીની બાધતમાં, નિરાશ્રિતને આશ્ર્ય આપવાની બાધતમાં, વિદ્યાર્થીને તેમનો અભ્યાસ ચાલુ કરવાની બાધતમાં ચોથ્ય મહાન આ કેન્દ્રસંસ વરદ્ધથી આપવામાં આવેલ છે. વળી કેટલેક સ્થળો હાનિકારક રીબાળે કેટલેક અંશે નાયુદ થયાના દાખલાઓ પેપરડારા આપણને માલમ પડેલા છે. વળી તેવીજ રીતે કેટલેક સ્થળો વિદ્યાશાળા, પાઠશાળા, કન્યાશાળા સ્થપાનોલ છે. કોઈ કોઈ સ્થળો મોડિઝનો પણ જન્મ થવા

વોરા હૃદીસંગ જ્યોરેચંદ્રનું આપણું

૧૭

પામેકા છે, અને છેવડે પ્રાન્તિક ડેન્ફરન્સો મળવાથી તે તે જિલ્લાના વસનાર આપણું કૈન બાંધુએને ડેન્ફરન્સથી શો લાસ છે તે જણાઈ ચૂક્યું છે; જેથી પાંચ વર્ષની ઉજવળા કારકીર્દી અનુપમ અને અગણિત કાર્યો કરનારી થઈ પહેલ છે. વળી તે સાથે સૌથી માટે લાસ આપણું એ થયેદ છે કે બુદા બુદા દેશમાં વસનારા બુદા બુદા કૈન બાંધુએ એક રથળમાં મળતા હોવાથી તેઓમાં ભાતુલાવ અને દીકસેળુ રાખતા શીખણ થીએ; અને તેના પરિણામે અરસ્પરસની ધાર્મિક અને વ્યવહારિક સ્થિતિનો આપણું ખ્યાલ આવ્યો છે. આ તમામ અને હુદે પણી તેથી વધારે અગણિત લાલો આ ડેન્ફરન્સની હૃયાતીથી, તેના દીધીબુંધ્યથી અને સમય બળથી થશે એવો નિઃશાંક સંલાઘ છે.

કેળવણી: દરેક દેશની કે ડેમની ઉત્ત્તુલિ થવી તેનો મુખ્ય આધાર કેળવણી ઉપર છે; અને દરેક દેશ અને ડેમનું સાંદ્ર નરસું ભવિષ્ય પણ તેના ઉપર લટકેલું છે. દેશની અને મતુષ્યની આધુનિક સ્થિતિ જેતાં જે ટકે દરજે ધાર્મિક, માનસિક અને શારીરિક કેળવણીની જરૂરીયાત છે તે ટકેજ દરજે હુંશર ઉદાગની કેળવણી આપવાની પણ જરૂર છે; કારણું દેશની અને મતુષ્યની આખારી અને આધિક સ્થિતિ સુધારવાનો અને ડંગાળીયત સ્થિતિ મટાહવનો તેજ સરલ અને સીધો રહ્યો છે. વળી કેળવણીનો બેણુણો પ્રચાર થવા માટે અને સાધારણું સ્થિતિના મતુષ્યો પણ કેળવણી લઈ શકે તેને માટે રકોલરશીપો, બોડિંગો અને એવા ધીજા રસ્તાઓ કરવાની આવસ્થયકતા છે. વળી તે સાથે ચોછા અંદે કેળવણી લઈ શકે તેવા રહ્યો કરવાની પણ સાથેજ જરૂર છે.

ચૈલ્યળ્ઝેન્ડાર: બાંધુએ! આજકાલ ચોલું નજરે પડે છે કે એક તીર્થસ્થળે અને એક શહેરના દેરાસરમાં લાગો રૂપીઆ હોય છે અને ધીજા તીર્થસ્થળે કે કેદી ગામના દેરાસરમાં તેના રક્ષણ માટે કે પૂજલક્ષ્મિ માટે કાંઈ પણ સાધન હોતું નથી. આવા સંચોગો વચ્ચે જે જે તીર્થો કે ગામેના જિનાલયોમાં તે બાયતના પૈસાનો જેઠાએ તે કરતાં વધારે હોય તેના વહીવટકતાએ વિચારણ જેઠાએ કે દરેક તીર્થ, જિનાલયો અને તેની અંદર ધીરજમાન થયેતા પરમાત્મા આપણ સર્વેને એક સરખામાનનીય અને પૂજનીય છે. તેથી જે જે સ્થળે ચૈલ્યો અને તીર્થો લુણ્ણું સ્થિતિમાં હોય કે લુણ્ણું સ્થિતિમાં આવતાં જતાં હોય તેવાં સ્થળોનું રક્ષણ કરવા, તેનો ઉદ્ધારે કરવા અને ખચાવવા તે પૈસાનો વ્યા કરવો ઘર્યા છે. દાખલા તરીકે સમેતશિખરદ્દ તેમજ જિરનારણ જેવા પવિત્ર તીર્થ ઉપર આપણ હુક સાણીત કરવામાં તેમજ ભરણ વિડ્રુદ્ધ ખાંધવા ધારેલ મકાનોથી થવાની આશાતના વિગેરે અટકાવવામાં પણ આવા દ્વારાનો ઉપયોગ કરવાની આવસ્થયકતા છે.

हनिकारक रीवानेः मनुष्यसङ्गीपी क्षेत्रनी आहर तेनि उत्तिरुपी धीज दहन थवामां हनिकारक रीवाने सुख्य छे. धर्मनी अवनति करनार, आचार-विचारमांथी पतन करनार अने देशने तथा केमने अधम स्थितिए पहेंचाडनार हनिकारक रीवाने छे. वगी ते साथे आपणा संसार अने व्यवहारने खुण मेणवनार पणु हनिकारक रीवाने छे. कन्याविकृथी पोतानी केमनी, धर्मनी अने देशनी अधम स्थिति, भाणलश्वथी शारीरिक संपत्तिनी मंदता तथा केगवणीनी अधम स्थिति अने वृद्धविवाही पोतानी पुत्रीनी अधम स्थिति थाप छे. तेमज भरण्य पाइण करवामां आवतो खर्च अने ऐवां घीनः केटलांड गेरवाजभी झरन्यात अर्थी आर्थिक स्थितिनो पणु नाश थाय छे. नयांसुधी आवा दुष्ट अने जट धाली गेडेका धण्णा काणना रीवानेनो हुद्यणा वापरी नाश नहीं करीचे लांसुधी आपणु संसार सुणी थवहो नथी; अने तेम नहीं थवाथी धर्मनी उत्ति पणु थवानी नथी; जेथी ते कुरीवानेने हुवे जलटीथी अनती गडेनते द्वार करवानी जडूर छे. यांधुओ! आटलु जोती के सांसारी गेसी रहेवानु नथी. परंतु के के डरावो अने पसार थाय ते ते सरल रीते अमलमां भूकाय ते भाषतनें तात्कालिक विचार करवाने आप साडेणने हु विनांति कडे छु. आप सर्वे सज्जनेने विहित हुयो के आपणा देशना उद्यने माटे हुयातीमां आवेद नेशनल केंचितने जेम सरकार पासे हुक मागवाना छे तेवु आपणु नथी. आपणु तो आपणी केमनी अने लविध्यनी प्रजनानी उत्ति करवानी छे अने ते आपणा प्रयासे आपणु जले करवानी छे. परंतु आवी महान् आणतमां हाटासाई, श्रीचंद्रशाह, गेनरल, हत्त अने गेल्यके जेवा महान् युद्धिशाळी अने राज्यनीतिनिषुणु पुरुषो के के धारे तो लाढो रुपीआ पेहा करी शके, तेम छतां देशना हितमां पोतानी युद्धिनो उपयोग करी, द्वार्थनो लोग आपी, पोतानी लांडगी देशसेवामां अर्पणु करी पोताना पवित्र वर्तननी छाप आपा देशमां महान् नर तरीके पारी छे, तेम आपणी केमना आजेवानेचे पोताना नतिलेप्यथी, श्रीमंतोचे पोतानी लक्ष्मीची, गेल्युचेटा अने विद्वानेचे पोतानी विद्रुताथी अने युद्धिनिषुणु नरांचे पोतानी युद्धिथी उपर अतावेला देशसेवा करनारा नरानु अनुकरणु करी, आपणी केमनी, धर्मनी अने लविध्यनी प्रजनानी उत्ति थवा माटे आत्मकोग आपवानी जडूर छे.

ज्ञाला यांधुओ! हिंहुस्ताननां घीनः मेटां शहेरोनी जैन वस्तीना ग्रमाणुमां अहोनी जैन वस्ती व्यापाराहिमां केटलेक अशो पाइण छे; जे जेतां आवु महान् अर्थे करी आपा हिंहना श्री संघ अत्ये आमंत्रणु करवानी अमो हिंमत करी युक्तिए नहीं; परंतु अमारा दयाणु, आणेश अने पोतानी विद्रुता तथा पोतानी

બોધ હૃદીસંગ અવેરદ્યંહતું ભાષણ.

૧૬

પ્રભા. તરફના પૂર્ણ ખારને લીધે આયા હિંહુસ્તાનમાં સર્વજ સ્થળે પંકાચેલા છે એવા, નૃપતિઓના શિરોમણિ અને અત્ર ર્ધીસાજમાનથચેલા અમારા નેકનામદાર મહુરાજ સાહેબ સર ભાવસિંહલું બહુદુર કે. સ્ટી. એસ. આઇ. ની તમામ પ્રકારની સહૃદયતા મળવાના પાકા લદોંસાથાં અમોએ આપ સાહેણોને આમં-
બણું કર્યું હતું; અને અમોન અત્યારે જણાવતાં જુશી ઉપજે છે કે અમારા આ દ્વારા મહુરાજનો કૃપાવંત થઈને અમોને અમારા ધાર્યો કરતાં ધાર્યી વધારે સહૃદય આપી છે કે માટે અમે સર્વે એ નામદાર મહુરાજ સાહેણોનો અંતઃકરણ-પૂર્વક આલાર માનીએ છીએ, અને પરમાત્મા પ્રત્યે ગ્રાર્થના કરીએ છીએ કે તેઓ દીર્ઘાયુધી થાએનો અને તેમનું રાજ્ય અમર તપો. વિશેષમાં આ રાજ્યના અમારા નામદાર દિવન સાહેણ કે જેઓ હુમેશાં આવાં કાઢ્યો માટે દિલસોણ ધરાવે છે અને કિમતી સંદાહ આપવા સાથે દરેક પ્રકારની સગવડ કરી આપે છે તેઓ સાહેણોને પણ આ સ્થળે ઉપકાર માનવો એ અમારી આસ કરજ છે.

હું છેવટે મારે મારી એકન ક્રજ અનુવાની બાકીમાં રહે છે, તે એછે કે અહીંની રીસેપ્શન કમીટીએ આપણી કેન્દ્રરન્સની ઇટેહને માટે કે વીર પુરુષને પ્ર-
મુખ તરીકે ચુંટી કાઢેલ છે અને કે ગૃહસ્થ આપની સન્મુખજ બીરનેલા છે
તેની ઓળખાણ આપવી. આ ક્રજ અનુવાં મને ધળ્યું હર્ષ ઉત્પજ થાય છે
કારણુકે મારે કે વીરરતનની ઓળખાણ પાહવાની છે તેની ઓળખાણ આપવી
અથ્ય અગાઉજ આપ ઓળખણી શકો તેમ છે કેમકે એ ગૃહસ્થ આપણી કેમભાંજ
નહીં પણ આણા. હિંહુસ્તાનમાં પ્રખ્યાત છે, વ્યાપારમાં બહુ આગળ વધેલા છે,
અણોદ્ધાર, પુસ્તકોદ્ધાર, ડેણવલુને ઉતેજન, નિરાશ્રિતને આશ્રય ધત્યાદિ કા-
ર્થના પોતાના દ્રોધનો સોટી સંખ્યામાં વધ્ય કરનારા છે, આ જમાનાના ઉદાર
પુરુષોમાં પ્રથમ પંક્તિમાં મૃદુવા યોગ્ય છે, સાથે ધર્મચુસ્ત છે; વળી વિદ્યાદેવીના
પણ ઉપાસક છે કે જેની ખાત્રી તમારે તેમનું ભાષણ કરી આપશો, મારે કહે-
વની જરૂર રહેશે નહીં. આજા આપણી કેમભાંજ આગેવાન ગણુતા અને આગે-
વાનપણુને દરેક રીતે લાયક એવા પુરુષને પ્રમુખ તરીકે શોધી કાઢવાથી અર્હીનો
સાધ ધણોજ મગારૂ થયેલ છે એવા એ વીરરતન શેઠ મનસુખલાઈ લગુભાઈ.
છે. એંગો ધળ્યા નીર્ધાદ્વિવાન અને પૂર્ણ વિવેકી લેવાથી તેમના પ્રમુખપણું
નીચે આપણી કેન્દ્રરન્સનું ક.મ ઇટેહમંદ રીતે પાર ઉત્તરવાનો પરિપૂર્ણ સંભવ છે.

પુષ્પરદ્ય મેલાવડામાં લેવ વા સ્થાનોના પ્રતિનિધિએ તેમજ વીજીટર સાહે-
એએ કેમના કલ્યાણ અર્થે અને પદ્ધારવા તરદી લીધી છે તેથી તે સર્વને એકવાર
કરીથી સાનંદ વદને આવકાર આપુંછું અને આપની વકિત તેમજ સતકાર કરવામાં

જે કંઈ નગ્નતા હોય અને આપની સાગવડ જાળવવામાં જે કંઈ આમી હોખાય તેને માટે થબા કરવાની યાચના કરું.

ગ્રસુઅ માટેની દરખાસ્ત, અનુમોદન અને ટેકો: રીસેપ્શન ક્રમીકીના ગ્રસુઅનું આવડાર આપણાં લાપણું અલાસ થયા પછી તુરતાં કુંઠી આગેવાન શેડ વેઢાલાઈ નરશી કેશવળુંએ નેજ ઉપર ઉભા થઈ શેડ મનસુઅલાઈ લગુલાઈને ગ્રસુઅસ્થાન આપવાની દરખાસ્ત કરતાં જણાયું કે “પવિત્ર મુનિ મહારાજાનો, નેક નામદાર મહારાજ સાહેબ, પ્રિય કેન બાંધુઓ અને સુશીલ બહેણો! આજની આ મહાનું સમાનો લાભ મેલાવડો લેછ મને અતિ આનંદ થાય છે અને તે આનંદ વર્ણિવવા મારી પાસે પૂરતા શપદો પણ નથી. શ્રી કેન સંઘની સર્વ પ્રકારે ઉત્તિ કરવાના માર્ગો યોજવાના જે મહાનું કાર્ય માટે આપણે એકવ થયા તીવ્ચે તે સુકાર્યને સાંગેપાંગ પાર ઉત્તારવા ડેઢ લાયક અને યોગ્ય કેન ગૃહસ્થને આ સલાના નાયક તરીકે નીમવાની માન લરેલી દરખાસ્ત આ સલા સમય મારે રણું કરવાની છે. મુંબદી ધાલાકાના કેનપુરી તરીકે કહેવાતા શુજાતના પાટનગર અમદાવાદના સુપ્રસિદ્ધ લાણ્દીતા શ્રીમંત ગૃહસ્થ શેડ મનસુઅલાઈ અગુલાઈનું નામ આપણે દરેક કેન સારી રીતે જાળે છેજ. સુખ્ય લીંગોની હેખરેખ રાખવામાં, જાન અને વિદ્યાની વૃદ્ધિ કરવામાં, સ્વધર્મી બાંધુઓને અનેક પ્રકારની સહાયતા આપવામાં અને હુંકામાં એક શ્રીમંત અબેસરને છાજતાં સુકર્મી કરવામાં તેઓ સાહેબ હુમેશાં તન મન અને ધનથી સર્વદા તત્પર રહે છે, તેમજ અનેક મીળો જેવા ઉદ્યોગ કર્યોમાં જેદાયદી છતાં તેઓ અંતસમાગમ કરી અનેક ધાર્મિક કાર્યોમાં પોતાના વખતનો મેટો લોણ આપે છે. તેઓની વર્તણું અરેખર એક શ્રીમંત શ્રાવડને યોગ્ય છે. આવાં અનેક કારણોથી તેઓ આપણી મહાન સમાજનું અધ્યક્ષસ્થાન લેવાને યોગ્ય નર છે, અને હું ધાર્યું કે આપ સર્વનો પણ અતઃકરણી વેજ અભિપ્રાય હોયો જોઈએ. અનેક સવાકોપર આપણે અતે વિચાર કરવાનો છે અને વખત બંદું થોડો છે, તેથી તેમની લાયકાત પર વિશેષ વિવેચન ન કરતાં તેઓ આપણું આ મહાલારત કામમાં દરેક રીતે મદદગાર થઈ આપણું કાર્ય કરેલું હોઈયોનીથી પાર પાડી આપણેજ એટલું જણાવી શેડ મનસુઅલાઈ લગુલાઈને આ છઠી કેન શ્વેતામણ ડેન્ટસન્સના પ્રસુઅ તરીકે નીમવાની દરખાસ્ત આપ સમય હું કરું છું અને મને આશા છે કે આપ સર્વ તેને એકમતે ને એકઅવાર્દે રાહૂર્ય સ્વીકારશો.” (તાણીઓના અવાજો ચાલુ.)

ભાવનગરના નામદાર મહારાજ સાહેબનું ભાષણ.

૨૧

મી. શુક્રાભયંદળ દઢાએ સદરહુ દરખાસ્તને ટેકો આપતાં રોઠ મનસુખલાઇની ઉદારતા અને ધાર્મિક વચ્ચે વૃત્તિપર વિવેચન હું હતું અને તેમ કરતાં તેમની સખાવતો ડેવી રીતે સર્વદેશીય હતી, તે જાણુવતાં અમદાવાડમાં તેઓ તરફથી થયેલ હોસ્પિટલનું દસ્તાં આપ્યું હતું. કેળવણી ઉપર ને તેઓનો પ્રેમ ખતાવી આપતાં તેઓશ્રી તરફથી ચાલતી સ્કૂલ તરફ ધ્યાન જેંચયું હતું અને આશા ખતાવી હતી કે કે દરખાસ્તને અનુમેદાન આપવા તેઓ ઉલા થયા છે તે સર્વાતુમતે પસાર કરવામાંજ આપશે.

વોરા અમરચંહ જસરાને તે દરખાસ્તને વિશેષ ટેકો આપ્યા
બાદ સદરહુ દરખાસ્ત તાણીએના ગડગડાઈ વચ્ચે સર્વાતુમતે પસાર કરવામાં
આવી હતી અને રોઠ મનસુખભાઇ લગુલાદ્યે સર્વના હર્ષ વચ્ચે બાધુ અ-
મીચંહ પભાલાલ તરફથી ખાસ તૈયાર કરાવેલ અને કેન્દ્રરન્સને અર્પણું કરેલ
રૂપાની સુરશીપર પોતાની બેઠક લીધી હતી;

ત્યાર બાદ નામદાર મહારાજા સાહેબ કેચો પ્રથમથીજ પદારેલા હુતા તેઓએ આપી કૈન કેમને માન આપનારું ભાષણ હું હતું. આ આપ્યું ભાષણ દરેક કૈનને માન કરવા ચોણ્ય છે, કૈન કેમ તરફનો તેઓનો અપૂર્વ પ્રેમ ખતાવનારું છે, લંઘદ્યાના સિદ્ધાન્તને પ્રતિપાદન કર્યારું છે, અને દરેક રીતે ધ્યાન આપવા લાયક છે. એ ભાષણ અમે આપ્યું અને ઉતારી લેણું ચોણ્ય ધારીએ છીએ. તેઓશ્રીએ મધુર સ્વરે જણાયું કે—

**શ્રી છુટી કૈન કેન્દ્રરન્સના પ્રમુખ સાહેબ, તથા ભાવનગર સંસાનકા-
 રિલીસ સલાના પ્રમુખ સાહેબ તથા બંધુએ અને ગૃહસ્થો ! તમારા
 સંબન્ધાન આ અભ્ય મેવાવડામાં મને થયેલા આમંત્રણથી આવતાં
 મને ઘણ્ણો હર્ષ થાર, છે. તમારી આગળ હું ધાણું કામ કરવાનું
 ઉપસ્થિત થયેલું છે, અને કેમ વડોદરાના નામદાર મહારાજા ગાયકવાડ સર-
 કારે પૂર્વના આવાજ કેચે પ્રસંગે કણું હતું તેમ ને કામ તમારા પ્રમુખને
 કરવાનું છે તે હું કરવા માગતો નથી, એટાં લાંબું શિક્ષણ આપવાની પદ્ધતિ
 અહણું કરવાનો આવશ્યકતા નથી. હું માત્ર તમે તમારું કામ ડેવી રીતે કર્યા-
 છો તે જેઠ રાણ થવા આવ્યો છું. મારી આજની હુક્મરી તમારા નેતા ત-
 રીકેની નહીં પણ એક શુલેચ્છક પ્રેક્ષક તરીકેની છે, અને મારી એવી હાજ-
 રીથી તમને ખુશી હુંસ ન થઈ હોય તેના કરતાં તમને આવા મોટા સમૂહને આવાં
 સારાં કામ માટે મારા શહેરમાં લેજા થયેલા જોઈ મને એર વધારે આનંદ થાય છે.**

जैन संघे पेताना स्वउद्योगथी आ महान् कोऽन्द्रनस भेणवी छे, ते कृतां प्रवृत्त तरीके तसे भागेली अने मारी इरज तरीके में आपेकी यत्किंचित् भद्रने तसे उपकार भानवा योग्य दास गणी आलार भानवानो विवेक क्षेयो छे, ते मने योग्य लागतुं नथी. हिंदुस्ताननी राज्यभक्त प्रजाने राजा तरइ एक ऐवी अपूर्व अजितानी लागणी छाय छे के जे राजना देश वात्सल्यने पछु अपूर्व दृपातुं चिन्ह भानी ले छे. तमे ते लागणीथी होरवाई आलारे मारे भाटे आलारसूचक शाष्ट्रो गोदो छो, ते तमारी अजितने गमे तेटलुं योग्य छाय पछु भने तो ले में काँઈ कुर्चु छाय तो भारी इरज कृतां काँई विशेष कुर्चु छाय एवुं लागतुं नथी.

राजा अने प्रज मर्णाने राज्यशरीर गण्य छे. राज्यहेठुं उत्तमांग राजा अने ईति अंगो प्रज छे. देहुना हरेक अंगना धर्मो ते जेम आपा शरीरना धर्मो छे, तेम प्रजना धर्मो ते राज्यशरीरना धर्मो छे, अने ते नियमे भारा अंगित धर्मना लेवी लागणीथीज हुं भारी प्रजना धर्मो तरइ जेउ छु. विचार करतां तो जेम पछु लागे छे के हरेक भनुप्य जन्मथीज जैन छे, केम्के अज्ञान दशामां पछु हरेक अ॒ष पेतानुं रक्षणु करवा तरइ प्रवृत्त छाय छे. “भारी छे तेवो अ॒ष जीजनो पछु छे” यो भानने अभावेज भाषुस पशुवत् वर्ती जैन धर्मना त्याग करे छे. आडी स्वल्पावे तो हरेक प्राणी अ॒षहयावाणो एट्वे जैनक छाय छे.

सांध, ज्ञाति के समाज आवा भेलावडा करी पेतपेताना सामाजुक वर्तनोमां सुधारणा करे ए खहु छन्दिवा लायक वात छे. प्रज जे प्रभाषुमां पेतपेताना धार्मिक, व्यवहारिक डे परस्परनां वर्तनो जीजनी हायकणीरी वगर पेताथीज निर्णित करे छे; ते प्रभाषुमां तेनी उभतितुं भाप थवु योग्य छे. धर्मभां के आनगी वर्तनमां के ज्ञातिना रीतीवाजेमां राज्यशासननी जडूर पडे, ए अंदर अ दरना भत्तेहेठुं अने पेताना व्यवहार पेते यत्वावानी अशक्तात्यानुं चिन्ह छे. उभतिनो भूज मंत्र एज होवो जेहुये के पेतानां डामोनो तंत्र जेम बने तेम धधो पेताना हुआथमां होवो जेहुये. केाँई पछु अमुक लक्ष्मीद्रव्य डे सत्ताद्रव्यना भाप धारणु करवामां उभतिनी परिचीमा नथी, पछु ऐवी स्थितिनी आमिये उभति छे के जे स्थितिमां अन्यना आश्रयनी आपेकु काँई जडूर पडे नहीं. जेट्वा प्रभाषुमां भाषुस जीजना आश्रयनी जडूरीयातथी स्वतंत्र, तेट्वा प्रभाषुमां तेट्वो ते उभत, जेम जडी व्याप्या झाँझु छु. आवा संघोना भूज आशये एट्वाज् भाटे व्याप्तवा लायक छे

સાધનગરના નામદાર ભજુઓની સાહેભનું લાપણ.


૨૩

કે અંદર અંદર વિચાર કરી એકમત થઈ સમાને પોતાના આનગી વ્યવહારો
અને વર્તનો પોતાથી નિર્ણિત કરે છે.

પ્રણ ઉપર રાત્તા ચલાવનાર રાજ સત્તાનો બંદર છતાં, જે પ્રમાણુમાં
તેને ઉપથોગ તેને થોડો કરવો પડે, તેટલા પ્રમાણુમાં તેની પ્રગત થોડી વર્તન-
વાળી અને ઉભે સમજવી; અને જેટલા પ્રમાણુમાં રાજ વગરકારણું પ્રણનાં
આનગી કર્મોમાં વચ્ચે ન આવનાં પોતાની સત્તાનું ભાન તેમને આંદું થવા હે,
તેટલા પ્રમાણુમાં તે રાજ તે પણી યોગ્યતાવાળો અને સત્તા જીવનાની શક્તિ-
વાળો સમજવો. આમ હોવાથીજ સાંદ્રીક મેળાવડાયો થવા હેવાળી હુલની ઉચ્ચ
રૂપજીતિ હુસ્તી લોગવાળી હોય એમ મને લાગે છે. મને પોતાને રાજસંસ્કારો
માન આપતી મારી સુડીલર પ્રણ પોતાથી પોતાનાં સાંસારિક કર્મો ચલાવી
શે, મારે વચ્ચમાં ન આવવું પડે એમ પોતાના જીવનના ધારાઓ પોતાથીજ બાંધી
તે પ્રમાણે વર્તે, એમ હું ખરા અંતઃકરણીઠ દુચ્છું છું; અને તેથી આવા મેળા-
વડ ભરી લોકો પોતાની ઉજ્જ્વલિના રસ્તાઓ થોડે છે તે નેર્ધ મને આનંદ
થાપ છે. રાજનું કામ સુરક્ષેત્રી ઉની કરવાનું નહીં પણ આવી પડેલી સુરક્ષેત્રી
અને દૂર કરવાનું છે; અને તેથી કાયદાઓને પરણું સમાજે ઉપર ઇંકુનાની
નીતિ કરતાં જમજૂનીથી અને અંદર અંદરની વ્યવસ્થાથી લોકો પોતાને વ્ય-
વહાર ચલાયે એ હું વધારે પસાંદ કરે છું, અને તે તરફનો તમારો આ પ્રયત્ન
એ ઘણાં વર્ષોથી ચાલુ છે તે ઇનીભૂત થાય, અને હીલ જાતિઓ એ પગદે
ચાલે, એમ હું દુચ્છું છું.

અહિસા એ દેશક ધર્મનાં સૂત્રમાં એક સૂત્રરૂપે છે, પણ જેને ધર્મમાં નિય-
પતા એ દેખાય છે કે ગ્રાહી માત્ર તરફ અહિસાની નગરસ્થીજ એ ધર્મ
એકરીને જુઓ છે. હિસાનો અર્થ એકલો વધજ થતો નથી. એ
પારકાને દુઃખ થાય તેવી રીતે આપહુરણ કરવું એ હિસા
સાથી મન, વચ્ચ, કર્મથી દૂર રહેવું, એ અહિસા
સ્વાર્પણની દિલ્લિવાળા પાણી શકે.

સ્વાર્પણનો એ માટો નિયમ જેને
છે, અને સ્વાર્પણ એ સંપ્રસારક મોટું સાર
તિની આશા રાખેવાં એ સંઘ સહીસલામત
ધર્મથી માંડીને ચારે પુરુષાર્થ સુધીના એ
મંડળને એક ધારણુમાં લાવી સુકવાનો તમારો


 અનુભૂતિની પ્રાણી વિશ્વાસી વિશ્વાસી
 અનુભૂતિની પ્રાણી વિશ્વાસી
 અનુભૂતિની પ્રાણી વિશ્વાસી
 અનુભૂતિની પ્રાણી વિશ્વાસી

માન કરું છું. અહિસા પરમોર્ધમઃ એ મહા વાક્યનો વોષ કરનારી અને ઘણી સહીઓથી લુધનમાં ઉતારનારી પ્રજનમાં ચારે પુરુષાર્થમાં સંપ્ર અને એકય થતું એ સુલભ છે. હિંદુસ્તાનની પ્રજનમાનો ને કેાઈ પણ ધર્મસમૂહ એક મત થવાનો સંલખ હોય તો તે સ્વલ્બાર્થીજ શાંત અને પારકાનું મન હુખવામાં અચક્ષતો કંન ધર્મસમૂહજ છે. એ પુરુષાર્થમાં તમે સફળ થાઓ તો મત બેઠને તમે હુમેશને માટે તમારા સંધમાંથી દેશનિકાલ કરી શકશો, અને એકસંપનો ણહુ ઉડા પાયો તમે નાણી શકશો, કેને એકસંપ સર્વ ઉત્ત્રતિનું મૂળ સૂત છે. ધર્મ, ડેગવણી અને રીવાળે ઉપરના તમારા સર્વના મતબેદો દ્વરા થઈ તમે સંપનાં સુખ અનુભવો એવી મારી શુલેચ્છાઓ હું તમારી સંદ્રમાં સોંપું છું, અને તમારું આ સ્તુત્ય કામ નિર્વિદ્ધ અને સુખરૂપ પાર ઉત્તે એવું અંતઃકરણપૂર્વક દ્યાખ્યું છું.

હું હું તમારા આજના નેતાને તેના સ્તુત્ય કામમાં મહા કરવાની તમને લલામણું કરું છું. પ્રાણી ને પ્રમાણુમાં પોતાના ધરના વડીલની આજામાં રહેતાં શીળયો હોય તે પ્રમાણુમાં તે સાંખીક નેતાઓને માન આપતાં શીળે છે, અને સાંખીક અધ્યક્ષને કે પ્રમાણુમાં માનની નજરથી જુઓ છે તે પ્રમાણુમાં દેશના અર્થીશ રાજ તરફ માનથી હોરાય છે, અને જેઓ દેશના રાજને માનથી લને છે તેઓજ જગતના ધ્યાયની આજાને માનનીય ગણે છે એમ સમજવાનું છે. એટલે આજે તમે તમારા આજના નેતા તરફ કે માન પ્રદર્શિત કરશો તે કેમ તમારા ધરબ્યવહારની સ્થિતિને બતાવી આપશો તેમ ધ્યકર અને રાજ તરફની તમારી અંતર લાગણીઓની કુંચી રૂપ ગણુંશે. આજના પ્રમુખને તમારા અધ્યક્ષ નીમવામાં તમે જેટલું તેમને માન આપ્યું છે તે કરતાં વધારે માન તમને પોતાને આપ્યું છે. યોગ્યની યોગ્ય સ્થળે પસંદની કરવામાં પસંદ કરનારાની યોગ્યતાનું માપ થઈ જાય છે, અને તમારી પસંદગી ઉપરથી તમે તમારી પોતાની યોગ્યતાની ઘણી સંતોષકારક પરીક્ષા જનસમૂહને આપી છે એમ કહેતાં મને હુર્ષ થાય છે. શેડ મનસુખભાઈ લગુલાઈ વિષે કેાઈ અનુભૂતું નથી. આર્થિક ઉત્ત્રતિના તેઓ નેતા છે એ તો એમના આર્થિક સાહસાથી સર્વસે વિદ્ધિ છે, અને બીજ ત્રણ પુરુષાર્થમાં પણ તેઓ તેવાજ ઊંઠી છે, એટલે તમને ચારે પુરુષાર્થ તરફ દેરવા માટે તેઓ યોગ્ય નર છે; અને તેમના નેતાયણાની તમે સહીસલામત હુથમાં છો એ જાણી નૈન સંધની અભિવૃદ્ધિ ધ્યાનાર દરેક માણુસ ઝુશી થાય એવું છે. હું તમેને કેમ હોરવામાં આવે છે, અને

શેડ મનસુધારણાએ ભગુલાઈનું ભાપણું

૨૫

તમે કેવા વિદ્યાસ અને લક્ષીથી તમારા શુદ્ધ કામગાં હોરાયો છો, તે નેવા હું ઈચ્છું હું.

શેડ મનસુધારણાએ ભગુલાઈનું ભાપણું: નામદાર મહારાજના ભાપણ દરમયાન વારંવાર લાળીઓના અવાજે થતા હતા અને હરના પ્રેક્ષકોટે જીલાંગવા ખાડું આતુરતા બાતાવતા હતા. ઉક્ત ભાપણ અત્યમ થયા પછી શેડ મનસુધારણાએ ભગુલાઈનું પોતાનું વ્યવહાર ભાપણ થરૂ કર્યું. આખું ભાપણ મનન કરવા યોગ્ય છે, વ્યવહાર સૂચનાઓથી ભરપૂર છે, અનુભવનો નમુનો છે અને આસ ધ્યાન રાણી વાંચવા લાયક છે. તેઓ સાહેબે ચાર પૃષ્ઠ વાંચ્યા પછી બાંધીનો લાગ એવલાવાળા પ્રસિદ્ધ વક્તા દમોહર બાપુશાંશે પૂર્ણ કર્યો. આ ભાપણ પ્રથમથી વહેંચેલું હોવાથી મંદુમાંથી શાંતિ રહી શકી નહિ. આ ભાપણના ખાડું ઉપયોગી ક્રિકેટાંથી આસ મનન કરવા યોગ્ય હોવાથી અને વિસ્તારના લોગે પણ આખ્યા શિવાય રહી શકતા નથી. તેઓ સાહેબે મંગળાચરણ કરી જણાયું કે:—પવિત્ર સુનિવરો, નેકનામદાર મહારાજન સાહેબ, સ્વધર્મી ણંદુએ અને સુશીળ બહેનો ! આ જગતમાં મેં મારી જનતના હિતને માટે, કિંબા મારા જેનગંધુઓના હિતને માટે, કિંવા સામાન્ય જનહિતને માટે, કિંવા અન્ય ગ્રાહીઓના હિત કે ગચ્છાવને અર્થે જે કંઈ કર્યો કે પ્રયત્નના કર્યો હુશે તો તેમાં એક મનુષ્ય ગ્રાહી તરીકે અને વિશેષે કરીને એક જેનશાસનના અતુયાચી તરીકે મારું ધાર્મિક અને સામાજિક કર્તવ્ય જગતવ્યા શિવાય વધારે જે કંઈપણ દીઘેલું નથી. જલદે તે કર્તવ્ય પણ હું પુરેખું જનતવી શક્યોછું કે નહીં તે ખાખત હું શાંદાશીલ છું. મારા કરતાં વિક્રતા, વક્તવ્ય અને અનુભવ વિગરે વધારે ધરાવનારને અધ્યક્ષસ્થાન આપવામાં આવ્યું હોત તો વધારે યોગ્ય ગણ્યાત. આમ હતાં માગ જૈન ણંદુઓએ ઉત્સાહમાં આવી મનેજ અધ્યક્ષસ્થાન આપ્યું છે તો નભ્રતા અને આલારપૂર્વક તેનો સ્વીકાર કરીને હું મારું કામ આગળ ચલાવું છું. પ્રારંભનાં નામદાર શહેનશાહ અને જાવનગરના મહારાજ સર લાંબસાહીજ કે. રી. કોસ. આએ. બહાદુરનો અંતઃકરણપૂર્વક આલાર માતું છું અને મી. પટણી જેવા બાહોશ તથા વિક્રાન્ત વિવાન સેણવવા માટે જાવનગરની પ્રભાને ભાગ્યરાણી ગણ્યું છું.

દરેક કોમના આવા મહાનુસમાજનેની આવશ્યકતાઃ આ જગતમાં દરેક વ્યક્તિ પોતાનું કામ યથાસ્થિત રીતે પ્રબહિતના સંખ્યામાં કરી શકે તે સારુ મંદુંણી જરૂર છે. હિંદુસ્તાનની એકંહર સિથિતિ જેતાં દરેક ભાષતમાં વિચારની આદલાબદી અને સહૃદાયતા કરી શકે એવું આખ્યા હિંદુસ્તાનનું એક મંદું ખાંની શકવાને ઘણોજ આવકાશ જોઈએ. પરંતુ હિંદુ-

સ્તરાન જેવા દેશમાં હાલ કે જુહી જુહી રત્નિયા અને જૂદા જૂદા ધર્માં છે, તેમણે પોતપોતામાં એકૃયતા કરવી એ પ્રજાની એકૃયતાનું પ્રથમ પગલું છે, અને પ્રજાની એકૃયતા થવામાં સહેલામાં સહેલો સ્તરો પ્રજાનાં જીણાં જીણાં અંગે એક ધીજાની સવડને અતુસરીને પોતપોતામાં જોડાઈને જેમ જેમ એકૃયતાને પામતાં જાય તેમ તેમ પ્રજા મહુભાડળને વધારે ક્રેદાર કરવાને શક્તિમાન થાય એ વાત મારા મત પ્રમાણે નિર્વિવાદ છે. આ લારતવર્પની જૈન રવેતાં ખર ડેન્ફરન્સ ઉપર પ્રમાણે થવાની એક મહાન અને અગત્યતું પગથીયું છે. નામ ઉપરથીજ સ્પષ્ટ સમજ શક્તય ચોંબું છે કે આ ડેન્ફરન્સ પ્રત્યક્ષ રાજકીય હેતુ ધરીને થયેદી નથી. એમાં કે હેતુ રહેલા છે તે આપણું જિનશાસનને અતુસરીને તેમજ તેને મળતાં જૂદા જૂદા ધીજ ધર્મોમાં પણ નીતિ અને ધર્મનાં કે વાક્યો છે તેને અતુસરીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર બાળતોને લગતાજ છે. ધર્મતું આચારધન કરવાની, અંતરશુદ્ધિ રાખવાની તેમજ શાવકની હિન્દુચાર્યા અને છ આવદ્યક સેવયાની દરેક બાંધુની પ્રાથમિક ક્રરજ છે. જૈન ધર્મમાં જીવદ્યા પ્રાધાન્ય છે છતાં નાનાને પાણવા અને મોટાને નહિ પાણવા એવા આક્ષેપો કોઈ કોઈ ડેકાણે જૈન ધર્મના અનુભવ વળરના દોકેના સુખધી સાંલળવામાં આવે છે, પણ તેમણે જણાનું જોઈએ કે જૈન ધર્મમાં સર્વ જીવોની અપેક્ષાએ પંચનિર્દ્ધ જીવોને અને પંચનિર્દ્ધ જીવોમાં મતુષ્ય, જે સર્વ જીવોનું રક્ષણુ કરી સ્વપરતું કલ્યાણ કરવાને શક્તિમાન છે તેને પ્રાધાન્ય આપેલું છે.

જીણુંચૈત્યોદ્ધાર: ચૈત્યોની બાળતમાં પૂર્વ કાળથી જૈન બાંધુનો ઘણ્ણાજ ઉત્સાહી, લક્ષ્મિમાન અને આગળ પડતા જણ્ણાચેલા છે અને તેના દાખલાઓ હાલ આપણી પાસે મેળુદ છે. આપણીજ નાલકમાં તીર્થાધિર્જન શરૂંજ્ય, ગિરનાર, આખુ અને તારંગાના પર્વત ઉપર જાઓ તો લાં પણ જિન ચૈત્યોની ભવ્યતા આપણી પાસે અણીજ રહેલે છે. ઉપર બતાવેલાં ચૈત્યો કે વળતે બાંધવામાં આચ્યાં હુશે તે વખતે તે બાંધનાર મહા પુરુષોની ભક્તિ, ઉત્સાહ અને સમૃદ્ધિ કેટલી હુશે તેનું અનુમાન કરવાને પણ હાલ આપણે શક્તિમાન થઈ શકતા નથી. આવાં પુરાતન તીર્થ અને દીર્ઘિસ્તાસ્થા જોઈને આપણે અભિમાન ધરવાનું નથી, પણ અભિમાન છોડવાતું છે અને કરવાતું એ છે કે આપણું અંતઃકરણુની એટલે દરનું શુદ્ધ થઈને નિરાન તે મહા પુરુષોને પગલે ચાલવાની પણ આપણામાં સ્પુર્તિ આવે અને તેમને પગલે ચાલીએ. શ્રી પૂલુંચાયેંદ્ર કહું છે કે—“નવીન દેરાસર બંધાવતાં કે ઝળ થાય છે તેના કરતાં આઠગણું પુષ્ય

શેડ મનમુખભાઈ ભગુસાઈનું ભાપણું

૨૭

અહોદ્વારથી થાય છે." આ વાક્યનો આશાય બાહુ વિચારવા લાયક છે, અને તેમાં ઘણ્યું ગૂઢ અર્થ સમાયદો છે. લક્ષિત અને શ્રદ્ધાથીજ નેકે આપણે નવીન હેરાસર અંધાવીએ તોપણ તેમાં એક જીતનો આપણા મનમાં અહુંકારનો અંકુર ડિસ્પલ થલાનો સાંલવ છે. કે કણમાં હાનિ કરે છે, પણ જેવી રીતે દ્યા ઉત્પન્ન થવાથી આપણે જીવસ્થાણ માટે જે કાર્યો કરીએ છીએ તેમાં ધર્મવૃદ્ધિ, દ્યા, શાંતતા વિગેરે સહદ્વિત્તિએ શિવાય અહુંકાર, પ્રમાદ વિગેરે કોઈપણ અસરદ્વારિતિનો પ્રયેશ થતો નથી, તેજ પ્રમાણે આ અહોદ્વારની બાધતમાં માનવાનું છે, અને તેજ કારણથી શાસ્કારે આઠગણું ક્ષળ ખતાંયું છે. શત્રુંભય, ગિરનાર, આપું વિગેરે સ્થળોનીજ પસંદણી એવી કરવામાં આવી છે કે ત્યાં શુદ્ધ હ્લાસ, શુદ્ધ જળ મળી શકે છે અને ત્યાં જવાથી સર્વ જતની વિષયવાસનાઓ અને કામનાઓ ફૂફત સ્થળનાજ કારણથી હૂર થઈ જય છે. ચૈત્યોની રચના, બાંધણી, કારીગરી, વિશાળતા, એ બાધતો ઉપર એટલું લક્ષ આપવામાં આવ્યું હોય છે કે તેની અંદર હાયલ થતાંજ આપણા અંતઃકરણુમાં એક જતની ભૂય ધર્મવૃત્તિ પેદા થાય છે. એટલે દરજને જેમણે આપણા ઉપર જે કાર્યથી ઉપકાર કરેલો છે અને અધ્યાપિ પર્વત કેનોની જોણજલાલી પૂર જેસમાં જગાવી રાખી છે તેમનું નામ અને તે કાર્ય સાચવી રાખવા દ્વારાએ આપણું તથા અનેક લભ્ય જીવેને થતો ભાવોહ્લાસ અને શ્રદ્ધાવૃદ્ધિ ચિરસ્થથાની કરવાને આપણાથી બનતો પ્રયત્ન આપણે ન કરીએ અને તેથી કરીને તે ચૈત્યોના અરિતત્વમાં આમી આવે અને તે આપણે જેયા કરીએ તો આપણે કેટલી મોટી ભૂલ કરીએ છીએ તેનો શાસ્કદ્વારા નિર્ણય કરવાનું કામ પણ હું મારા ધર્મબંધુઓનેજ સેંપું છું. નવીન એક ચૈત્ય બાંધવામાં આપણે જે ખર્ચ કરીએ તેટલા ખર્ચમાં ઘણાં જુનાં ચૈત્યોનો ઉદ્ધાર થઈ શકે એ વાત નિર્ધિવાદ છે. ચૈત્ય બાંધવાના હેતુઓમાં મુખ્ય એ હેતુ રહેલો છે કે તેનો લાલ લઈને આપણા સંખ્યાણધ ધર્મબંધુઓ અંતઃકરણની શુદ્ધિ કરીને ધર્મમાં વધારે પ્રેરાય, તે હેતુથી પણ જેતાં એક નવીન ચૈત્ય બાંધવાથી જેટલી સંખ્યાને લાલ નણવાનો તંત્ના કરતાં ઘણાં જુનાં ચૈત્યોનો અહોદ્વાર થાય તો તેથી ઘણી મોટી સંખ્યાને અધ્યર્વ્દ ભાવોહ્લાસનો લાલ મળે એમાં સંશ્ય નથી. મારું ઉપર ખતાયેલા વાક્યમાં અહોદ્વારથી જે વિશોષ ક્ષળ થવાનું અંથકારે ખતાંયું છે તે યથાસ્થિત હોવાથી ઉત્સાહથી અને અંતથી આપણે તેનું અનુકરણ કરલું દ્યા છે. આ ઉપરથી જરૂરી નવીન ચૈત્યો નહિ બાંધવાં એમ મારું કહેલું નથી, પણ ત્યાં લાલાં અહોદ્વાર કરવા જેવાં ચૈત્યો છે લાં નવીન ચૈત્ય નહિ બાંધતાં અહોદ્વાર પાછળ દ્રવ્ય અર્થવું જોઈએ.